

વર्ष : ૩૫  
અંક : ૬  
જૂન-૨૦૧૧

શહેર સંતશ્રી આત્માનંદજી પ્રેરિત

Retail Price Rs. 5/- Each

# દિવ્યધ્વનિ

આધ્યાત્મિક મુખ્યપત્ર

શાશ્વત પરમ આનંદ



એકતા

સમતા

લઘુતા

ધ્યાન

સેવન

વંદન

ચિંતવન

કીર્તન

શ્રવણ

“શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન;  
લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણા.” - અધ્યાત્મકષિ શ્રી બનારસીદાસજી

## શ્રીમદ રાજયંત્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર

(શ્રી સત્યાંત્ર - સેવા - સાધના કેન્દ્ર સંચાલિત)

કોલા ૩૮૨ ૦૦૭. (જિ. ગાંધીનગર, ગુજરાત)

ફોન : (૦૭૯) ૨૩૨૭૬૨૧૯, ૨૩૨૭૬૪૮૩-૮૪ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭૬૧૪૨

E-mail : [srask@rediffmail.com](mailto:srask@rediffmail.com), Web.: [www.shrimad-koba.org](http://www.shrimad-koba.org)

## આપણી સંસ્થામાં પૂજય મોરારી બાપુનું આગમન (તા. ૨૮-૪-૨૦૧૧)



## આપણી સંસ્થામાં ચોજાયેલ સ્વાધ્યાયશ્રેણિ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવો (તા. ૮-૫-૨૦૧૧ થી તા. ૨૩-૫-૨૦૧૧)



આદ. બા. દ્ર. શ્રી પવનભેદ્યા



આદ. બા. દ્ર. શ્રી પંકજભેદ્યા, આદ. બા. દ્ર. શ્રી કમલભેદ્યા

## આદ. શ્રી સુવણાભેનના વરસીતપના પારણાની વેળાએ (તા. ૬-૫-૨૦૧૧)



# દિવ્યધન

## અનુક્રમણિકા

- (૧) શ્રી સદગુરુપ્રસાદ ..... શ્રીમદ્ રાજચંદ્રજી ..... ૩
- (૨) ધૂઘટ કા પટ ખોલ ..... પૂજયશ્રી આત્માનંદજી ..... ૪
- (૩) રત્નગ્રાણ ..... શ્રી મહિભાઈ શાહ ..... ૭
- (૪) ભૂલની આદત અને ચિંતાનો બોજ .....  
..... ડૉ. કુમારપાળ દેસાઈ ..... ૮
- (૫) શ્રી પદ્માંદિ આચાર્ય .. પ્રા. ચંદાબહેન પંચાલી ..... ૧૪
- (૬) બાર ભાવના ..... પૂજય બહેનશ્રી ..... ૧૬
- (૭) શ્રી આનંદધન ચોવીશી . શ્રી અશોકભાઈ શાહ ..... ૨૦
- (૮) અપૂર્વ અવસર ..... શ્રી વલભજી હીરજી ..... ૨૩
- (૯) ભિક્ષાપાત્ર વિનાના ભિખારી ! શ્રી ચંદ્રહાસ ત્રિવેદી ..... ૨૪
- (૧૦) આચાર્યશ્રી પૂજયપાદસ્વામી .. બા.બ્ર.અલકાબેન ..... ૨૬
- (૧૧) ધારો તો તમે ..... શ્રી ધૂની માંડલિયા ..... ૨૭
- (૧૨) સ્વાધ્યાય-સાર ..... શ્રી મિતેશભાઈ શાહ ..... ૨૮
- (૧૩) બાળવિભાગ ..... શ્રી મિતેશભાઈ શાહ ..... ૩૨
- (૧૪) Yuga Times ..... ૩૪
- (૧૫) સમાજ-સંસ્થા દર્શન ..... ૩૬

વર્ષ : ૩૫

જૂન, ૨૦૧૧

અંક - ૬

## શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક શાધના કેન્દ્ર

(શ્રી સત્શુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત)

કોબા - ૩૮૨ ૦૦૭ (જ. ગાંધીનગર, ગુજરાત)

ફોન : (૦૭૯) ૨૩૨૭ ૬૨૧૬/૪૮૩/૮૪

ફેક્સ : (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨

srask@rediffmail.com

www.shrimad-koba.org



:- પ્રેરક :-  
શ્રેદ્ધયશ્રી આત્માનંદજી

:- સંપાદક :-  
શ્રી મિતેશ એ. શાહ

:- સ્વત્નાધિકારી :-  
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક  
સાધના કેન્દ્ર  
(શ્રી સત્શુત-સેવા-સાધના કેન્દ્ર  
સંચાલિત)

:- મુદ્રક-પ્રકાશક :-  
ડૉ. શ્રી શર્મિષ્ઠાબેન એમ. સોનેજી  
ટ્રસ્ટી, શ્રીમદ્ રાજચંદ્ર  
આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા

:- પ્રકાશન સ્થળ :-  
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક  
સાધના કેન્દ્ર  
કોબા - ૩૮૨ ૦૦૭  
ફોન : (૦૭૯) ૨૩૨૭ ૬૨૧૬  
૨૩૨૭ ૬૪૮૩/૮૪  
ફેક્સ : (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨  
srask@rediffmail.com  
www.shrimad-koba.org

:- લાવાજમ શ્રેણી :-

ભારતમાં  
ત્રિવાર્ષિક રૂ. ૧૮૦  
આજીવન રૂ. ૭૫૦  
પરદેશમાં

By Air Mail

ત્રિ-વાર્ષિક : Rs. 2500  
\$-60, £-35

આજીવન : Rs. 7000

\$-170, £-110

By Sea Mail

આજીવન : Rs. 3500  
\$-85, £-60

## લેખકો / ગ્રાહકો / વાચકોને

- ⇒ ‘દિવ્યધ્વનિ’ દર મહિને પ્રગટ થાય છે.
- ⇒ કોઈ પણ અંકથી ગ્રાહક થઈ શકાય છે.
- ⇒ ગણ વર્ષથી ઓછી મુદ્દતનું લવાજમ સ્વીકારવામાં આવતું નથી.
- ⇒ ચેક/ડ્રાઇટ/એમ.ઓ. ‘શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા’ના નામનો મોકલવો.
- ⇒ સહુ સ્વજનો-મિત્રો વધુમાં વધુ ગ્રાહકો નોંધાવીને સહયોગી બને તેવી વિનમ્ર અપેક્ષા છે.
- ⇒ ગ્રાહકોએ પત્રવ્યવહારમાં પોતાનો ગ્રાહક નંબર અને પૂરું સરનામું અવશ્ય લખવું. ગ્રાહક નંબર સરનામાની ઉપર લખેલો હોય તે નોંધી રાખવા વિનંતી છે.
- ⇒ સરનામામાં ફેરફાર થાયાની જાણ તાત્કાલિક કરવા વિનંતી છે.
- ⇒ કોઈપણ લેખ સ્વીકારવો કે ન સ્વીકારવો કે કુમશઃ લેવો તેનો સંપાદક મંડળને સંપૂર્ણ અધિકાર રહેશે.
- ⇒ લેખકોનાં મંત્ર્યો સાથે સંપાદક મંડળનું સહમત હોવું આવશ્યક નથી.



: મુદ્રણસ્થાન :

ભગવતી ઑફસેટ

૧૫/સી, બંસીધર ઑસ્ટેટ, બારડોલપુરા,  
અમદાવાદ - ૩૮૦ ૦૦૪  
ફોન : ૨૨૧૬ ૭૬૦૩



## પ્રાર્થના

હે આત્મા !

જે અચિત્ય જ્ઞાનાદિ અનંત ગુણોના સમૂહથી શોભતું પરમપદ, પરમાત્મસ્વરૂપ શ્રી સર્વજ્ઞ ભગવંતે પોતાના કેવળ જ્ઞાનમાં દીહું, તે પદનું વર્ણન અપૂર્વ વચનયોગના ધારક એવા ખુદ સર્વજ્ઞ શ્રી તીર્થકર પ્રભુ પણ પૂજાપણે કહી શક્યા નાછે, તો તેવા ચિંતનાતીત, વચનાતીત, ગુપ્ત ચમત્કારદુર્પણને બીજા કોઈ છજ્ઞસ્થની વાણી કેમ વર્ણવી શકે ? કેમ કે તે સર્વોત્તમ પદનું સંપૂર્ણ જ્ઞાન માત્ર અનુભવગોચર છે.

હે પ્રભુ !

હું અલ્યક્ષ, મંદમતિ આપના અદ્ભુત ગુણોનો પાર કેમ પામી શકું ? હે ગુણાના સમુદ્ર, દિવ્ય તેજસ્વી ગુણોના ધર્તા ! મને આપના પ્રગટ ગુણો જોઈને બહુમાન થાય છે. તે સર્વ ગુણ મને અત્યંત પ્રિય છે, ઈષ છે. હે કૃપાળુ ! પરમકૃપા કરી, ઉપકાર કરી આપના અપૂર્વ, દિવ્ય, અલૌકિક અને અદ્ભુત ગુણોનું સિંચન આ આત્મામાં કરતા જશો એવી આ દીન પામરની વિનંતી છે.

હે કરુણાનિધાન !

મિથ્યાત્વ (ઉંઘી માન્યતા)ને ધારીને સંસારમાં અનંતકળથી રખી રહ્યો છું. અનંત જન્મોમાં અનંત દુઃખ ભોગવવા છતાં માન્યતાનો દોષ ન છોડ્યો. જન્મનો થાક ન લાગ્યો. જરા (ઘડપણ) જોઈને વીતરાગભાવ ન થયો. મરણ જોઈને સમશાન વૈરાગ્ય આબ્યો અને દેહ છોડતાં દુઃખ પણ ખૂબ થયું પરંતુ પ્રાપ્ત પર્યાયમાં તન્ય થવાની વૃત્તિ અને રુચિને લીધે પુનઃ એમ જ થયું. જોકે હવે મને આપની વાત કાને પડી છે, રુચિ થઈ છે. આ બધી આપની જ કૃપા છે. વીતરાગ પુરુષોએ બતાવેલા માર્ગ ચાલવાનો પ્રયત્ન આદર્થો છે. સત્પુરુષોની આજાએ ચાલતાં અમે પૂર્ણત્વને અવશ્ય પામીશું એવી શ્રદ્ધા છે. આપની અનરાધાર કૃપા અમારા પર વરસતી રહે તેવી યાચના કરું છું.

॥ અં શાંતિ: શાંતિ: શાંતિ: ॥

# શ્રી સદગુરુપ્રસાદ

# શ્રીમદ્ રાજચંદ્રજી

ਪੰਜਾਬ - ੪੮

વવાણિયા, માહ, ૧૯૪૫

જિજ્ઞાસુ,

આપના પ્રશ્નનો ઉત્તર, મારી યોગ્યતા પ્રમાણે, આપનો પ્રશ્ન ટાંકીને લખું છું.


પ્રશ્ન :- વ્યવહારશુદ્ધિ કેમ થઈ શકે ?

ઉત્તર :- વ્યવહારશુદ્ધિની આવશ્યકતા આપના લક્ષ્યમાં હશે, છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસારગ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે; વ્યવહારશુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિઃશંક છે.

(૧) જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, અને રળવાની જેને જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવું જોઈએ.

(૨) જેને ધર્મ સંબંધી બોધ થયો છે, ઇતાં સ્થિતિનું દુઃખ હોય તો બનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ. (સર્વસંગપરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમોથી સંબંધ નથી)

(3) ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં  
જેનું મન લક્ષ્મીને માટે બહુ જાવાં નાખતું હોય  
તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછ્યું.  
તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ  
ભાગ આવતો હોય, કિંવા પારિણામિક લાભને



હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ  
આવતું હોય તો મનને સંતોષી લેવું;  
તેમ છતાં ન વળી શકે તેમ હોય તો  
અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા  
સુખનું કારણ થાય તેવી થવી જોઈએ.

(૪) પરિણામે આર્તધ્યાન ધ્યાવાની જરૂર પડે, તેમ કરીને બેસવાથી રળવું સાણું છે.

(પ) જેણું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણો કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને કે વચનને ન હોય. અનાચારથી મન સુખી થતું નથી, આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે.

(૬) ન ચાલતાં ઉપજીવન માટે કંઈ પણ અત્ય અનાચાર (અસત્ય અને સહજ માયા) સેવવો પડે તો ભાગશોચથી સેવવો, પ્રાયશિક્ષિત ધ્યાનમાં રાખવું. સેવવામાં નીચેના દોષ ન આવવા જોઈએ :-

૧. કોઈથી મહા વિશ્વાસઘાત, ૨. ભિત્રથી વિશ્વાસઘાત, ૩. કોઈની થાપણ ઓળવવી, ૪. વ્યસનનું સેવવું, ૫. ભિથ્યા આળનું મૂકવું, ૬. ખોટા લેખ કરવા, ૭. હિસાબમાં ચૂકવવું, ૮. જુલમી ભાવ કહેવો, ૯. નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો, ૧૦. ન્યૂનાધિક તોળી આપવું, ૧૧. એકને બદલે બીજું અથવા ભિશ કરીને આપવું, ૧૨. કર્મદાની ધંધો, ૧૩. લાંચ કે અદતાદાન.

- એ વાટેથી કંઈ રળવું નહીં.

એ જાણો સામાન્ય વ્યવહારશુદ્ધિ ઉપયોગન  
અર્થે કહી ગયો. (અપણી)

## ધૂંઘટ કા પટ ખોલ...

**પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી**

ધૂંઘટકા પટ ખોલ રે,  
તોહે પિયા મિલેંગે (૨)  
ઘટ ઘટ મેં વહ સાંઈ રમતા,  
કદુક વચ્ચન મત બોલ રે.  
તોહે પિયા....

ધન જોબનકો ગરબ ન કીજૈ,  
જૂઠા પચરંગ ચોલ રે. તોહે પિયા....  
શૂન્ય મહલમેં દિયના બારિલે,  
આસનસે મત ડોલ રે. તોહે પિયા....  
જાગ જુગુતસોં રંગ મહલમેં,  
પિય પાયો અનમોલ રે. તોહે પિયા....  
કહે કબીર આનંદ ભયો હૈ,  
બાજત અનહદ ઢોલ રે. તોહે પિયા....



કબીરજીનું જીવન અનેક રહસ્યોથી ભરેલું છે. તેમની ડિશોરકાળજી કારકિર્દી તથા કેળવણી વિશે ખાસ માહિતી ઉપલબ્ધ થતી નથી. તેમના જીવન વિશે જે માહિતી મળે છે તેના પરથી કહી શકાય કે તેઓ વણકર હતા. અત્યંત ગરીબીમાં ઉછર્યો હતા. સિક્કદર લોદીના શાસનકાળ દરમિયાન તેઓ બનારસમાં રહેતા હતા. રામાનંદ નામના ગુરુના તેઓ શિષ્ય હતા અને તેમને પોતાને પણ અનેક શિષ્યો હતા. તેઓએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરેલો મનાય છે. તેમની પત્નીનું નામ લોઈ, પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું. તેઓના જીવન અને બોધ ઉપરથી તેઓને ગૃહકાર્યમાં તદ્દન અનાસક્તભાવ હતો તેમ જાણી શકાય છે. સમસ્ત મનુષ્યો પ્રત્યેના તેમના પ્રેમથી, તેમની મધુર હૃદયસ્પર્શી વાણીથી અને વાર્તાવાપોથી તેમજ વિશિષ્ટ પુણ્યપ્રભાવથી જનતાના બધાય સ્તરના લોકો તેમના પ્રત્યે મોટી સંખ્યામાં આકર્ષિયા હતા.

**ધૂંઘટકા પટ ખોલ રે, તોહે પિયા મિલેંગે...**

દરેક અજ્ઞાની જીવ ઉપર અજ્ઞાનનો પડદો પડેલો હોય છે; જેથી તેને વસ્તુ તેના મૂળ સ્વરૂપે ન દેખાતાં તેનાથી અવળી જ દેખાય છે.

પરમતત્ત્વ શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રાંક ૫૦૬ માં કહ્યું છે કે, “ચક્ષુને વિષે જેટલી જાંખપ છે, તેટલો જાંખો પદાર્થ તે દેખે છે. અને જો અત્યંત બળવાન પડળ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી.” અહીં તો અવળી શ્રદ્ધા હોવાથી

જગતના જીવોને બધું અવળું જ દેખાય છે. અજ્ઞાનરૂપી પડદો એટલો મજબૂત બની ગયો છે કે તે સહેલાઈથી ખૂલ્લી શકે તેમ નથી. માટે મહાત્મા કબીરદાસજીએ ‘પટ ખોલ’ શબ્દને ત્રણવાર કહ્યો છે.

ਪਿਧਾ ਮਿਲੋਂਗੇ

જ્ઞાનીપુરુષના માર્ગે ચાલવાથી આપણા  
આત્માનું કલ્યાણ થાય એટલે કે ક્ષમા, માર્દવ,  
આર્જવ આદિ ગુણોના બનેલાં આત્માની પ્રાપ્તિ  
થાય - તેની અનુભૂતિ થાય.

घट घट में वह साँझ रमता,

કટૂક વચન મત બોલ રે. તોહે પિયા મિલેંગે....

પરમકૃપાળુદેવે ‘અમૂલ્ય તત્ત્વવિચાર’ની  
હેલ્લી કરીમાં કહ્યું છે કે,

“રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ એને ઓળખો,  
સર્વાત્મમાં સમદાચિ ઘો, આ વચનને હૃદયે લખો.”

હે ભવ્ય ! શીખતાથી તારા આત્માને  
ઓળખી, સર્વ જીવમાં તે ભગવાન આત્માના દર્શન  
કર. કોઈ જીવને તારાથી દુઃખ ન થાય તેવો પ્રયત્ન  
કર. તને જે નથી ગમતું તેવો વ્યવહાર તું બીજા  
સાથે ન કર.

आत्मनः प्रतिकलानि परेषां न समाचरेत् ।

### - भूनस्त्रभृति

તને સુખ ગમે છે માટે દરેક જીવને તારો  
બ્યવહાર સુખરૂપ થાય અને કોઈને તું હુંખરૂપ ન  
થાય તેવું તારું જીવન બનાવ કારણ કે દરેક ઘટમાં  
(દેહમાં) ભગવાન આત્મા બિરાજમાન છે. માટે  
કોઈના હદ્યને હુંખ થાય તેવા કડવાં વચન બોલવા  
નહિ. સંતો તો કહે છે કે વાણી અને પાણીને  
દવાની જેમ વાપરવા જોઈએ.

આપણી વાણીનો ઉપયોગ કેવી રીતે, ક્યારે  
અને કેટલો કરવો તેના માટે સદ્ગુરુદેવ આપણને  
કહે છે કે,

ધીરે સે બોલો, પ્રેમ સે બોલો,  
આદર ટેકર બોલો, જરૂરત હોને પર બોલો.

ધર્મ વાતો કરવાથી કે પ્રવચન કરવાથી નથી  
મળતો પણ આચરણમાં મૂકવાથી - દરેક જીવને  
પોતાના સમાન આત્મા માનવાથી મળે છે.  
ધન જોખન કો ગર્વ ન કીજૈ,

જૂઠા પચરંગ ચોલ રે. તોહે પિયા...

આપણે જે શરીરમાં રહીએ છીએ તે કાચના  
પમાન છે. તે ગમે ત્યારે ફૂટી જશે. આ દેહ  
યારે નિત્ય-શાશ્વત અને આપણો નથી તો  
મોટર, બંગલા, પુત્ર, પરિવાર તે બધા  
આ ક્યાંથી થઈ શકવાના છે? માટે આજાકારી  
સુશીલ પત્ની, કીર્તિ, વૈભવ - લક્ષ્મી  
નો (ગર્વ) અભિમાન કરવું નહિ કારણ કે તે  
ધૂય-પાપના ખેલ સમાન છે. આ દેહ છૂટાં  
વૈભવ-લક્ષ્મી અહીં જ પડ્યા રહેશે. આત્માની  
આવશે નહીં. માટે તેમાં જે અહું-મમત્વ થયું  
ઓ ત્યાગ કરવો તો ભગવાન આત્માની પ્રામિ

शन्य महलमें दियना भारिले।

આસનસે ભત ડોલ રે. તોહે પિયા....

આપણા હદ્યમાં અજ્ઞાનરૂપી અંધકાર છે.  
તેને જો દૂર કરવો હોય તો સદ્ગુરુનું શરાણ લેવું  
જોઈએ. સદ્ગુરુદેવ જ્ઞાનરૂપી પટારો ખોલીને  
આપણને સત્ય વસ્તુનું જ્ઞાન કરાવે છે કે હે ભાઈ !  
તું ચૈતન્ય સ્વરૂપી આત્મા છે, આ દેહ (મડું) તે  
તારું સાચું સ્વરૂપ નથી. માટે શરીરની સુંદરતા,  
બળ વગેરેને તું પોતાના માનીશ નહીં. આ બધું

તો પુણ્યના ઉદ્યથી પ્રામ થાય છે. આમ, સદ્ગુરુદેવ જ્ઞાનરૂપી જ્યોતિ હૃદયમાં પ્રગટાવે છે; જેથી હૃદયમાં અનાદિકાળથી પડેલ અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ જાય છે.

પરમતત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે,

“જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ.”

માત્ર શાસ્ત્રો વાંચવાથી આત્માની પ્રાપ્તિ થઈ શકે નહિ. કારણ કે શાસ્ત્રોમાં મોક્ષનો માર્ગ કહ્યો છે પણ તેનો મર્મ તો સત્પુરુષના હૃદયમાં રહ્યો છે. માટે ‘આસન સે મત ડોલ’ એટલે પદાર્થનો નિર્ણય કરી લે, શ્રદ્ધા પાકી કરી લે. ગંગાસતી કહે છે કે પદાર્થનો નિર્ણય થઈ જાય પછી તેની શ્રદ્ધા અવિચન થઈ જાય છે -

મેરુ તો ડગે પણ જેના મન ના ડગે,

ભલે ભાંગી તે જાયે બ્રહ્માંડ રે.

જગ જુગતસો રંગ મહલમે,

પિય પાયો અનમોલ રે. તોહે પિયા...

‘જગ જુગતસો’ એટલે હવે આ જગતના વ્યવહારિક કાર્યો છોડી સદ્ગુરુ દેવે બતાવેલ ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાયરૂપી સાધનો દ્વારા જગૃતિપૂર્વક આ ‘રંગમહલ’ એટલે કે દેહદેવળમાં બિરાજેલ ‘પિયા’ એટલે શુદ્ધ આત્મા મળવાથી અત્યંત આનંદ ઊપજ્યો છે. અર્થાત્ સદ્ગુરુએ ચીંઘેલ જ્ઞાનજ્યોતિ (રત્નત્રય) ને સમ્યક્કપણે આરાધવાથી - નિરંતર તેનો અભ્યાસ કરવાથી આત્માનો સાચો આનંદ પ્રગટ્યો છે.

કહે કબીર આનંદ ભયો હૈ,

બાજત અનહૃદ ઢોલ રે. તોહે પિયા મિલેંગે...

અહીં કબીરદાસજી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થવાથી સાચો આનંદ પ્રગટ્યો છે એ વાત સમજાવવા માટે ‘બાજત અનહૃદ ઢોલ’ એમ કહે છે.

આમ, ઘૂંઘટનો પટ ખોલવા અર્થાત્ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે બાધ્ય પદાર્થો - વ્યક્તિઓ પ્રત્યેનું મમત્વ ઘટાડી તેમજ અહંનો ત્યાગ કરી સદ્ગુરુનું શરણ અહણ કરી, તો ઓશ્રીની આજ્ઞાનુસાર જીવન જીવવું આવશ્યક છે. આપણે સૌ આવો પ્રયત્ન કરીએ.

॥ અં શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥

### સજ્જનના કર્તવ્યો

**પ્રેષક :** ગુલાબચંદ ધારશી રાંભિયા ધર્મબુદ્ધિ ધારણ કરી, થાજે દીન દ્યાળ, સત્ય વચન નિત્યે વદી, સત્ય રાહે તું ચાલ. પર ઉપકારો સાધવા, નિત્ય રાખજે ભાવ, ન્યાય તણા શુભ માર્ગમાં, ટેક ધરીને ચાલ. નિજ બાંધવ સ્વધર્મભીમાં, નિત્ય રાખજે વ્હાલ, સમતા રાખી વર્તજે, ધરજે નહિ મન કાળ. દ્યા ધરીને દાનથી, બચાવજે કંગાળ, મનમાં નિત્ય સંભારજે, પાપીના શા હાલ. માતા-તાતની સેવના, કરજે તું તત્કાલ, હે શ્રાવકસુત સર્વદા, કર્તવ્યો સંભાળ.

### કંજૂસાઈની પરાકાણા !

સુમી પૂછે સૂમને યું ક્યોં મુખ મલિન ?  
કુછ ગાંઠ સે ગિર ગયો ઔર કિસીકો દેન ?  
નહિ ગાંઠસે ગિર ગયો, નહિ કિસીકો દેન,  
ઔરકો દેતો દેખકે, મેરા મુખ મલિન.

# ରତ୍ନାବ୍ୟ

## સમ્યક્જ્ઞાન (કમાંક - ૧૩)

ବିଭାଗ ଅଧ୍ୟକ୍ଷ

(ગુરું કથી ચાલ)

રત્નગ્રાદ એટલે સમ્બુદ્ધશન, સમ્બુદ્ધજ્ઞાન  
અને સમ્બુદ્ધારિત્ર - આ ત્રણ રત્નોની એકતા.  
સમ્બુદ્ધશન વિષેની વિચારણા ગયા અંકમાં પૂરી  
કરી. હવે સમ્બુદ્ધજ્ઞાન વિષે વિચારીએ.

આપણે જોયું કે હું આત્મા છું, મને મળતાં  
સુખ-હુખ એ મારા પોતાનાં બાંધેલાં કર્મનું ફળ છે  
અને આત્મા ઉપરથી બધા કર્મો નીકળી જાય તો  
શાશ્વત સુખ રૂપી મોક્ષ મને પ્રાપ્ત થાય. તો આ  
આત્મા કેવો હોય, આ બધાં કર્મો શી રીતે બંધાય,  
તે ક્યારે, કેવાં અને કેટલાં ફળ આપે, આ કર્મોને  
બાંધતાં અટકાવી શકાય કે કેમ, લાગેલાં કર્મોને  
ભોગવ્યા સિવાય ખપાવી શકાય કે કેમ, મોક્ષ ક્યાં  
છે, કેવો છે - વગેરે બાબતોનું જ્ઞાન થાય તેને સમ્યક્  
જ્ઞાન કહે છે અને પછી એ પ્રમાણે આચરણ થાય  
તેને સમ્યક ચારિત્ર કહે છે.

કર્મ-આત્મા-મોક્ષ વગેરે વિષે આપણે ‘દિવ્યધ્વનિ’માં લગભગ ૧૫૦ લેખ દ્વારા સાત-નવ તત્ત્વોની માહિતી મેળવી છે, પણ અત્રે ટૂકમાં આપણે વિચારીશું.

વ્યવહારમાં એમ.એ., પીએચ.ડી., સી.એ.  
વગેરે થયેલાને આપણો જ્ઞાની કહીએ છીએ અને  
વ્યવહારમાં એ જ્ઞાન ઉપયોગી પણ થઈ પડે છે.  
પરંતુ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે,

‘નહીં જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો  
ફોક’ એટલે તો અમણે કહું કે

“હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગાડા છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આભિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં.”

જૈનદર્શનમાં જ્ઞાન કોને કહેવાય તે માટેના  
ઇ મુદ્રા ‘સમાણસુતમ્’ માં આપેલા છે, જે નીચે  
મુજબ છે.

“જેણ તર્યાં વિબુઝળેલ, જેણ ચિત્તં નિરૂજાદિ,  
જેણ અતા વિશુર્જેલ, તં છાણં જિનશાસને.”

- २५२

“જેણ રાગા વિરજઝેઝ, જેણ સેયેષુ રજાદિ,  
જેણ મિત્તી પભાવેજ, તં ણાણં જિનશાસને.”

- २५३

અર્થાત્ જેનાથી તત્ત્વો (સાત કે નવ) વિષે જ્ઞાણકારી મળે, જેનાથી મન ઉપર સંયમ આવે, જેનાથી આત્મા શુદ્ધ બને તેને જિનશાસનમાં જ્ઞાન કહે દે.

જેનાથી રાગદ્વૈષ જતાં રહે, જેનાથી આત્માને  
હિતકારી હોય તેમાં રચ્યાપચ્યા રહેવાય અને જેનાથી  
સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ જાગે તેને જૈનદર્શનમાં  
જ્ઞાન કર્યું છે.

આ બધી વાતો લગભગ સાત-નવ તત્ત્વમાં  
આવી જાય છે એટલે એ વિષે ટૂંકમાં વિચારીશું.

અગે એક વાત ઉલ્લેખનીય છે કે ભગવદ્ગીતામાં પણ ૧૩ મા અધ્યાતમાં જ્ઞાન કોને કહે છે તેના વીસ મુદ્રા કર્યાં છે. જૈન દર્શનમાં જે છ મુદ્રા કર્યાં, લગભગ એના વિસ્તારથી આ મુદ્રા

કહ્યાં છે. શલોક છે -

અમાનીતવં અદંભીતવં અહિસા ક્ષાન્તિરાર્જવમુ ।  
આચાર્યપાસનં શૌચં સ્થૈર્યમુ આત્મવિનિગ્રહઃ ॥  
ઈન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમુ, અનહંકાર એવ ચ ।  
જન્મ મૃત્યુ જરા વ્યાવિ દુઃખ દોષાનુદર્શનમુ ॥  
અસક્તિરન બિષ્વજ્ઞઃ પુત્ર દાર ગૃહાદિષુ ।  
નિત્યં ચ સમચિતત્વમુ ઈષાનિષોપપત્તિષુ ॥  
મધ્ય ચાનન્યયોગેન ભક્તિરવ્યભિચારિણી ।  
વિવિક્તા દેશસેવીત્વમરતિર્જનસંસાદિ ॥  
અધ્યાત્મજ્ઞાનનિત્યત્વં તત્ત્વજ્ઞાનાર્થ દર્શનમુ ।  
અનેતત્ જ્ઞાનમિતિ પ્રોક્તાં, અજ્ઞાનં યદ્તોન્યથા ॥

અર્થાત્ : અમાનીતવં (નિરભિમાનપણું), અદંભીતવં (સરળતા) વગેરે વગેરે ગુણો એ જ્ઞાન છે અને તે સિવાયના બીજા ગુણો અજ્ઞાન છે.

આમ, બધી દણિએ જોઈએ તો જ્ઞાન કોને કહેવાય તે જાણી શકાય.

આપણે સમ્યક્ જ્ઞાન વિષે વિચારી રહ્યા છીએ. સાત-નવ તત્ત્વો વિષેનું યથાર્થ જ્ઞાન તેને સમ્યક્ જ્ઞાન કહે છે. આ તત્ત્વો આ પ્રમાણે છે.

(૧) જીવ, (૨) પુદ્રગલ, (૩) આચ્ચવ, (૪) બંધ, (૫) સંવર, (૬) નિર્જરા અને (૭) મોક્ષ.

પુષ્ય અને પાપ એ તત્ત્વો બંધ તત્ત્વના પેટા ભાગ તરીકે એક આભ્નાયમાં ગણાવ્યા છે એટલે ત્યાં કુલ સાત તત્ત્વો કહ્યાં અને બીજી આભ્નાયમાં અને સ્વતંત્ર તત્ત્વો કહ્યાં એટલે ત્યાં કુલ નવ તત્ત્વો કહ્યાં. બધાં મળીને તત્ત્વો તો એ જ છે. આ દરેક તત્ત્વ શું છે તેને જોઈએ અને પછી તે તત્ત્વ વિષે થોડી ઉંડાણમાં વિચારણા કરીશું.

(૧) જીવ તત્ત્વ : દરકે જીવંત વ્યક્તિ - તે મનુષ્ય હોય, કીડી-મંકોડી હોય, સ્વર્ગની દેવતા હોય - દરેકના શરીરમાં આત્મા હોય છે. એ આત્મા એ શરીરમાં હોય ત્યાં સુધી અને સુખ-દુઃખનો અનુભવ થાય છે. આવા આત્માવાળા શરીરને

આપણે જીવ કહીએ છીએ. એ આત્મા કેવો હોય, વગેરે વિષે આગળ જોઈશું.

(૨) પુદ્રગલ : ઉપર કહ્યું તેમ આત્માને જે શરીર, કર્મો વગેરે લાગેલાં હોય તે એક જાતનાં રજકણો છે. એને પુદ્રગલ કહે છે.

(૩) આચ્ચવ : આત્માના ભાવ પ્રમાણે એને કર્મરૂપી પુદ્રગલો ચોટે છે - ખરેખર તો આત્મા જોડે ભળી જાય છે અને પછી યોગ્ય સમયે ફળ આપીને તે ખરી જાય છે.

(૪) બંધ : આચ્ચવથી આવેલાં કર્મો જીવને સુખરૂપ કે દુઃખરૂપ બને છે, જેને પુણ્ય-પાપ તરીકે ઓળખીએ છીએ. આ કર્મો કેવું ફળ આપે, ક્યારે ફળ આપે, કેટલું ફળ આપે, એ ફળને ભોગવ્યા સિવાય છોડી શકાય કે કેમ, વગેરેનું જ્ઞાન એ સમ્યક્ જ્ઞાન છે.

(૫) સંવર : ઉપર કહ્યું તેમ કર્મો બંધાય તો એ કર્મોને બંધાતાં અટકાવવા માટે શું કરવું તેનું જ્ઞાન એ સંવર કહેવાય છે. સુખી થવા માટે એ જાણવું જરૂરી છે.

(૬) નિર્જરા : અજ્ઞાન દશામાં કર્મો તો લાગી ગયા, પણ હવે જ્ઞાન થતાં, એ કર્મોને ફળ આપતા પહેલાં આત્મામાંથી ખેરવી શકાય શી રીતે, એ માટેનાં સાધન તપ વગેરે - એ બધાનું જ્ઞાન તે આ તત્ત્વ છે.

(૭) મોક્ષ : આત્મા ઉપરથી બધાં કર્મો નીકળી જાય એટલે એનો મોક્ષ થાય. આ મોક્ષ ક્યાં છે, ત્યાં આત્માને શો અનુભવ થતો હશે, ત્યાં કેટલો વખત રહેવાનું, બધા આત્માઓ મોક્ષે જાય તો આ દુનિયા ખાલી થઈ જાય ? વગેરે વિષે જ્ઞાન હોવું તેનું નામ સમ્યક્ જ્ઞાન.

આ પ્રમાણે સમ્યક્ જ્ઞાન અને તેના મહત્વ વિષે થોડા ઉંડાણમાં આવતા અંકથી વિચારીશું.

(કર્મશાસ્નક)

## ભૂલની આદત અને ચિંતાનો બોજ

## ਪਨਾਸ਼੍ਰੀ ਡੋ. ਕੁਮਾਰਪਾਲ ਦੇਸਾਈ

વ्यक्ति ધર्मશાસ્ત્રો પાસેથી ઘણું શીખે છે,  
ધર્મગુરુ પાસેથી ઘણું શીખે છે, પણ પોતાની  
ભૂલમાંથી બહુ ઓછું શીખે છે. આને પરિણામે  
જ જીવનમાં ડગલે ને પગલે ભૂલો થતી જોવા  
મળે છે અને એક ને એક ભૂલનું પુનરાવર્તન  
થતું રહે છે. એ માત્ર એક વાર ખાડમાં પડતો  
નથી, પણ વારંવાર ખાડમાં પડે છે અને આથી  
જો એ એની ભૂલને બરાબર જાણો, સમજે અને  
એના નિવારણ માટે દૃઢ સંકલ્પ કરે, તો એને  
પોતાનું જીવન સુધારવાની દિશા સાંપડી રહેશે.  
માણસના જીવનમાં આવતું દુઃખ અને થતી ભૂલ  
એના જીવનના મહાન ગુરુ બની શકે તેમ છે,  
પરંતુ માણસ દુઃખ કે ભૂલનો વસવસો કરતો  
રહે છે, કિંતુ એની ચિકિત્સા કરતો નથી.

તમારા જીવનમાં તમે કરેલી ભૂલનો તમે  
 વિચાર કરો તો જ્યાલ આવશે કે પહેલી વાર  
 ભૂલ કરી, ત્યારે બીજી વાર નહીં કરવાનો વિચાર  
 કર્યો હતો. બીજી વાર ભૂલ થઈ ગઈ પછી  
 ત્રીજી વાર એ જ ભૂલ કરતાં ઓછો ખચકાટ  
 થયો. ચોથી વાર બહુ સ્વાભાવિક રીતે તમે એ  
 ભૂલ કરી અને પાંચમી વાર તમે ભૂલ કરી  
 ત્યારે તમારી એ ભૂલ ટેવ કે આદતના સ્થાને  
 બેસી ગઈ હતી અને કશાય ખચકાટ કે થડકારા  
 વગર એ પ્રકારની ભૂલોની પરંપરા સર્જવા  
 લાગ્યા. પહેલી વાર કોઈને છેતર્યા બાદ હંદયને  
 જેટલો આંચકો લાગે છે, તેટલો પાંચમી વાર

છેતર્યા પછી લાગતો નથી. પછી છેતરવું એ બહુ સાહજિક બાબત બની જાય છે, અને એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર ફૂદતા વાંદરાની માફક એ વ્યક્તિ વધુ ને વધુ વ્યક્તિઓને છેતરવા લાગે છે.

લાખો રૂપિયાના કૌભાંડો કરનારાઓએ  
પહેલાં શરૂઆત તો હજાર-બે હજારની ઉચ્ચાપતથી  
કરી હતી, પણ ધીરે ધીરે એમાં ‘અધગતિ’  
કરી અને એને પરિણામે એમનું કૌભાંડ વધતું  
ગયું. પહેલી વાર કોઈને છેતરથી પછી મનોમન  
એમ થયું હોય કે ‘આ સારું કર્યું નહીં’, પણ  
પાંચમી વાર બનાવટ કરવાની કે છેતરવાની  
એવી આદત પડી જશે કે પછી એમ જાણ થાય  
કે ‘મારા આ કૌભાંડને કારણો કેટલાય ગરીબોએ  
માંડ માંડ બચાવીને એકઠી કરેલી ભૂતી ખર્ચાઈ  
જશે અને કેટલાયનાં જીવન તબાહ થઈ જશે’  
તો પણ પેલી ભૂલની આદત અટકવા નહીં દે.  
નાની નાની ચોરીથી શરૂ કરનાર મહાચોર બનતો  
હોય છે.

જીવનમાં વારંવાર ભૂલ કરતી વ્યક્તિની 'સ્ટાઇલ' જોવા જેવી છે. ભૂલ કરવાના અનુકૂળ સંજોગો હોય છે ત્યારે એ ભૂલ કરતો રહે છે, પરંતુ આવી ભૂલ અંતે છાપરે ચડીને પોકારે છે, ત્યારે એ ભૂલ કર્યાનો ભારે વસવસો કરે છે. ખોટું કર્યા માટે પસ્તાવો કરે છે. એના દોષનિવારણ માટે મંત્રજાપ કરે છે. કરેલાં

પાપમાંથી મુક્ત થવા માટે ગુરુનું માર્ગદર્શન લે છે. કોઈ પ્રાયસ્થિત આપવા કહે છે, પરંતુ આ બધું એ ત્યારે કરે છે જ્યારે, એના પાપનો ઘડો ભરાઈ ગયો હોય છે અને એનો સહુને ખ્યાલ આવી ગયો હોય છે.

જેને પરમનો સ્પર્શ પામવો છે એ વ્યક્તિ પોતાના જીવનમાં થતી ભૂલ તરફ કેવો અભિગમ દાખવશે ? એ પોતાની પહેલી ભૂલ અંગે જ ગંભીરતાથી વિચાર કરશે. એ પ્રથમ ભૂલ સમયે એને જાગ્રત થઈ જવાનું હોય છે. કોઈ કડવું કારેલું બાધું હોય અને પછી વ્યક્તિ મંનાંથી થૂ થૂ કરીને એને બહાર ફેંકી દે છે, પછી બીજી વાર એને ખાવાનું નામ ન લે, એવું જાગ્રત માનવીનું ભૂલ તરફનું વલણ હોવું જોઈએ. આવું વલણ ત્યારે કેળવાય કે જ્યારે વ્યક્તિની પાસે જાગૃતિ હોય અને પરમના સ્પર્શનું ધ્યેય હોય. જો એની પાસે જીવનનું કોઈ ધ્યેય નહીં હોય તો એને એની પહેલી ભૂલ સહેજે ગંભીર નહીં લાગે.

પરમને સ્પર્શનારા સાધકનાં જીવન પણ જોવાં જોઈએ કે જે મણો પોતાના જીવનમાં ભૂલ કરી, ત્યારે કેવો અભિગમ દાખવ્યો. એ ભૂલ થયા બાદ પોતાના જીવનને કઈ રીતે ગાળ્યું અને વાળ્યું. પુનઃ આવી ભૂલ ન થાય તે માટે કેવી જાગૃતિ દાખવી. મહાત્મા ગાંધીજીએ બાળપણમાં ચોરી કરી હતી અને વિકારો પણ અનુભવ્યા હતા, પરંતુ અમાંથી જીવનજાગૃતિને પરિણામે સામાન્ય અને સાધારણ બાળક મોહન વિશ્વવંદ્ય મહાત્મા ગાંધીજી બન્યા.

માત્ર પોતાના જીવનની ભૂલોમાંથી જ

બોધપાઠ મળે છે એવું નથી. અન્યના જીવનની ભૂલોમાંથી પણ આપણો બોધપાઠ મેળવી શકીએ છીએ. બીજાની સાથે અવિનયી, ઉદ્ઘત અને તોછડાઈભર્યું વર્તન કરનારને જાકારો મળતો જોઈને વ્યક્તિ પોતે વિચારે કે મારે જીવનમાં કેવું વિનયી અને સૌજન્યપૂર્ણ વર્તન કરવું જોઈએ. અભિમાન અને ઘમંડને કારણે ઘણું ગુમાવનારી વ્યક્તિને જોઈને અન્ય વ્યક્તિ એમ વિચારી શકે કે જીવનમાં નમતા એ ધારણા કરવા જેવો શાશ્વત છે. આખી જિંદગી વર્થ, અર્થહીન અને નકામી બાબતોમાં જીવન ગાળનાર વ્યક્તિને મૃત્યુને આરે નિઃસાસા નાખતો જોઈને બીજી વ્યક્તિ એટલો બોધ જરૂર તારવી શકે કે હું મારા જીવનમાં આવી ભૂલ નહીં કરું, આની માફક હું મારું જીવન વેડફી નહીં નાખું. આમ, એ બીજાની ભૂલને જોઈને પણ પોતાના જીવનમાં બોધ મેળવતો હોય છે અને સમયસર ચેતી જતો હોય છે.

વળી, એક વિલક્ષણ બાબત એ છે કે વ્યક્તિને માટે પોતાની ભૂલ જોવી મુશ્કેલ છે, જ્યારે અન્યની ભૂલ જોવી આસાન છે. સામી વ્યક્તિ કયા દોષને કારણ કેવી ભૂલ કરે છે, એ એનું મન તરત પકડી લે છે. આથી બીજાની ભૂલો જોઈને પોતાની જાતને સુધારવાનું પ્રમાણમાં આસાન છે. આથી કવિ ઉમાંશંકર જોશીએ એક વાર કંધું હતું કે ‘બીજાની ભૂલોમાંથી શીખો.’

હવે માનવમનને ધેરી વળતી ચિંતાનો વિચાર કરીએ. ઘરમાં કે બગીચામાં તમે હીંચકા પર બેઠા હશો. હીંચકાની એ ગતિનો વિચાર કરીએ તો એ સામેની બાજુએ છેક ઊંચે જાય

અને પછી એટલા જ વેગથી એ પાછળની બાજુએ  
ઉંચે જ શો. આમ, હીંચકો ખાતો મારાસ થોડા  
સમય પછી એ હીંચકો થોભાવે છે, ત્યારે એણે  
જ્યાંથી હીંચકો ખાવાનું શરૂ કર્યું હતું, ત્યાં જ  
આવીને ઉભો હોય છે !

બસ, આપણા મનમાં જાગતી ચિંતાની ગતિ આવી છે. ચિંતા તમારા મનને આમ-તેમ ખૂબ દોડાવશે. આગળ-પાછળ ખૂબ ધુમાવશે. વિચારોને ફરતા ભમરડાની માફક ગોળ-ગોળ ફેરવશે. ઘડિયાળના લોલકની જેમ એક બાજુથી બીજી બાજુ મન પળનાય વિલંબ વિના દોડતું રહેશે. આ બધાને અંતે વિચાર કરશો તો તમે જ્યાં હશો ત્યાં જ ઉભા હશો. જ્યારે હીંયકો ચાલતો હતો ત્યારે થોભીને એક શ્વાસ પણ લેવાનો સમય નહોતો અને એ અટકી ગયો ત્યારે જ્યાલ આવ્યો કે આ તો હતા ત્યાંના ત્યાં જ છીએ.

માણસ ચિંતાની ફેરફુદરડી ફરતો હોય છે, ત્યારે એ એમાં દૂબી ગયો હોય છે. હાથ હલાવી, આંખ મીંચીને ઘૂમતો હોય છે. આજુબાજુનું કશું દેખાતું નથી. વળી, આમાં કેટલીક ચિંતા એના મનમાં સ્થાયી રૂપે વસતી હોય છે. ડાયાબિટીસનો દર્દી સતત પોતાના રોગ વિશે ચિંતિત અને સભાન હોય છે. ક્યાંક કોઈ વાનગી જુએ અને પોતાને ડાયાબિટીસ છે, તેમ કહે તે તો બરાબર, પરંતુ એ સાંજ લટાર મારવા નીકળ્યો હોય ત્યારે પણ કોઈ સામે મળે તો એ બ્યક્ટીરિઓ એને કશુંય પૂછચું ન હોય, તો પણ પોતાના ડાયાબિટીસના રોગનું વર્ણન કરે છે. કેટલીક ચિંતા અસ્થાયી હોય

ઇ. શેરબજારમાં મંદીની અસર થાય, ત્યારે ઘણા લોકો ચિંતામાં દૂબી જતા હોય છે, જોકે સાથોસાથ એ જાણો છે કે તેજુ આવશે ત્યારે એમની આ ચિંતા દૂર થઈ જશે. કેટલીક ચિંતાને દૂર કરવી શક્ય હોય છે અને કેટલીક ચિંતાને દૂર કરવી અશક્ય હોય છે.

ચિંતાને દૂર કરવાનો ઉપાય શો ? આ  
ચિંતાને હીંચકે જુલાવવાને બદલે જરા હીંચકો  
પકડીને જમીન પર પગ ખોડીને ઊભા રહો,  
પછી વિચારો કે આ ચિંતાના નિવારણ માટે શું  
કરી શકાય ? એના કયા કયા ઉપાયો અને  
પગલાંઓ છે ? મનમાં અહીંથી તહીં કૂદટી  
અને સતત આમતેમ ઘૂમતી ફેરફુદરડી જેવી  
ચિંતાને ઊભી રાખો. એને ઊભી રાખ્યા પછી  
એ ચિંતાને બરાબર પકડી રાખો. એ ચિંતાને  
પકડ્યા પછી એને વિશે સાંગોપાંગ ચિંતન કરો.  
એનો ઉપાય શોધો અને એની અજમાયશ કરો.  
કર્મયોગી કે ધ્યાનયોગી પોતાના જીવનમાં આવતી  
ચિંતાગ્રસ્ત સ્થિતિમાંથી બહાર નીકળવા માટે  
આવો ઉપાય યોજે છે. આ ઉપાયને કારણે  
એમને આ ચિંતાનું સાચું સ્વરૂપ સમજાઈ જાય  
છે અને પછી એ ચિંતા જન્માવનારી બાબતોનો  
વિચાર કરશે અને તેને પરિણામે એમાંથી મુક્તિ  
પામવાના પ્રયાસો કરશે.

આપણી ઘણી ચિંતાઓની જનની આપણી  
સતત જરૂર લેતી નવી નવી અપાર છચ્છાઓ  
હોય છે. માણસ એટલી બધી છચ્છાઓ રાખે કે  
એની પ્રાપ્તિની ચિંતામાંથી એ છૂટી શકતો નથી.  
એ અપેક્ષા રાખે કે મારી પાસે વિશાળ બંગલો  
હોય, એ અપેક્ષા રાખે કે હું કરોડપતિ બની

જાઉં, એ અપેક્ષા રાખે કે મારા જીવનમાં હું અમુક ઉચ્ચ પદ હાંસલ કરું. આ અપેક્ષાઓ એના મનમાં સતત અથડાતી હોય છે અને એ અધૂરી અપેક્ષાઓ ધીરે ધીરે ચિંતાનું રૂપ લેતી હોય છે. જો વ્યક્તિ આત્મજાગ્રત કે આત્મસંતુષ્ટ હોય તો એને આ અપેક્ષાઓ પજવતી નથી. જેટલી અપેક્ષા ઓછી, એટલી ચિંતા ઓછી. એક અર્થમાં કહીએ તો એ પોતે જ પોતાની બાબુ છચ્છાઓને કારણો પોતાની જાતને આંતરિક રીતે દુઃખી અને ચિંતાગ્રસ્ત રાખતો હોય છે. આવી ચિંતાને ચિત્તમાંથી દૂર કરવી સરળ છે, પરંતુ માણસના મનમાં કેટલીક ચિંતાઓ સ્થાયી રૂપે એવું આસન જમાવીને બેઠી હોય છે કે જેને દૂર કરવી સર્વથા અશક્ય હોય છે.

વ્યક્તિનો એકમાત્ર પુત્ર વિકલાંગ હોય અથવા પોતાના શરીરમાં કોઈ મોટો રોગ હોય, તો આ ચિંતા એના મન પર સતત સવાર રહે છે. આવી સ્થાયી સમસ્યાઓની ચિંતા કરીને રોજેરોજ વ્યક્તિ પોતાના જીવનને વ્યત્ર બનાવે છે. મનમાં વિચારવું કે આવી ચિંતામાંથી મુક્તિ મેળવવી મારે માટે અશક્ય છે, તો શા માટે અશક્યને શક્ય બનાવતા પરમ તત્ત્વ પર શ્રદ્ધા મૂકીને જીવનું નહીં ? એ પરમાત્માએ ઘણી અસંભવિત વાતોને સંભવિત બનાવી છે, તો આ વાત પણ સંભવિત બને એવી શ્રદ્ધાથી એ ચાલે તો એનું ચિંતાનું કારણ આપોઆપ દૂર થઈ જશે. સામાન્ય માનવી ઘણી વાર ‘માટીના માણસથી જે શક્ય ન બને, તે ઈશ્વરથી શક્ય બને છે.’ એમ કહે છે.

આનો અર્થ એ નથી કે ઈશ્વર કોઈ

ચમત્કાર સર્જ અને ચપટીમાં આપણી અત્યંત દુઃખ પરિસ્થિતિ દૂર થઈ જાય. આનો અર્થ તો એ છે કે આવી પરમ પરની શ્રદ્ધાને પરિણામે જીવનદૃષ્ટિમાં એવું પરિવર્તન આવશે કે પછી દુઃખ એ દુઃખ નહીં રહે અને મનમાં સતત ઘૂમરાતી પેલી ચિંતા આથમી જશે. આમ, દૂર કરવી શક્ય હોય તેવી ચિંતા માટે પ્રયત્ન ને પુરુષાર્થ અને જ ચિંતા અશક્ય હોય તે માટે પરમાત્માની શ્રદ્ધા અને સર્મર્પણ જરૂરી બને છે.

સાધક વિચારે છે કે ચિંતા કરવાથી કશું વળવાનું નથી. મનમાં આર્તધ્યાન થશે, ઉદાસી છવાઈ જશે, વિબ્લષણ આવશે, બહાર ક્યાંય કશું ગમશે નહીં. કોઈ બોલાવે તો એ પસંદ પડશે નહીં અને કોઈ કંઈ પૂછે તો મન કાં તો અકળાઈને અથવા તો ગુસ્સાથી એનો ઉત્તર આપશે. ચિંતાગ્રસ્ત માનવીનો ચહેરો અને એનું આખું અસ્થિત્વ જ ચિંતામાં ઝૂભી જાય છે.

આવી રીતે ચિંતા કરતી વ્યક્તિઓને ઘણી વાર તમે સૂનમૂન બેઠેલી જોઈ હશે. વળી, ચિંતિત રહેવાને કારણો થતા જુદા જુદા રોગોની વાત તો ક્યાં કરવી ! આથી તો ચિંતાને ચિત્તા સમાન ગણવામાં આવી છે. જે ચિત્તમાંથી ચિંતાને કઈ રીતે દૂર રાખવી એ સમજી શકતો નથી, એનાં તન અને મનનું સ્વાસ્થ્ય બગડે છે, વ્યવસાયમાં એકાગ્રતાને અભાવે મનની સ્થિતિ પણ નબળી પડે છે અને તેથી જ આવી ચિંતા કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ એના સમયની અને જીવનની બરબાદી કરે છે. ઘણી વાર તો વ્યક્તિના જીવનનું આયોજન જ ચિંતા વધારનારું હોય છે. અવ્યવસ્થિત વ્યક્તિઓ સતત ચિંતામાં રહેતી

હોય છે, કારણ કે એમને દરેક કામ સમયસર પૂરું કરવામાં મુશ્કેલી પડે છે અને એથી પત્યેક કામ ચિંતાના બોજ સાથે કરતા હોય છે.

માનવી એની વૃત્તિ અને પ્રવૃત્તિ જે મ જે મ  
વધારતો જાય છે, તેમ તેમ એની છચ્છાઓ  
વધતી જાય છે અને આ વધેલી છચ્છા અને  
અપેક્ષા એને વિશેષ ચિંતામાં રાખે છે. વળી,  
એ ચિંતાના કારણના મૂળમાં જઈને સમીક્ષા  
પણ કરતો નથી. ઘણી વાર તો એ સ્વયં એનું  
કારણ હોય છે. એ જ ચિંતાનો જનક, પાલક  
અને પોષક હોય છે. ભગવાન બુદ્ધે આ અંગે  
પોતાના વિહાર દરમિયાન સહુને માર્ગદર્શન  
આપ્યું હતું.

ચિંતાના સંદર્ભમાં રૂડ્યાર્ડ કિપિંગે તો એવી સલાહ આપી છે કે “જો તમારો સ્વભાવ ચિંતા કરવાનો હોય, તો તમે ચિંતા કરીને ભલે આપત્તિઓને નિમંત્રણ આપો, કિંતુ એ તમારા પડોશીઓને ઉધાર આપશો નહીં.” આનો અર્થ એ કે ઘણી વ્યક્તિઓ પોતાની ચિંતાનાં બીજાની સમક્ષ ગાણાં ગાતી હોય છે, બીજી વ્યક્તિ એની ચિંતા સાંભળતી હોય છે, પરંતુ એ ચિંતા જાણીને એ બીજું કશું કરી શકતી નથી. આથી પોતાની ચિંતા બીજાને ઉધાર આપવી જોઈએ નહીં. એમ કરીને વ્યક્તિ પોતાના જીવનને વધુ વર્થ રીતે બરબાદ કરતા હોય છે.

ચિંતા એ મોહનિક્રા છે અને સાથોસાથ  
માનવીની નિક્રા પર અસર કરનારું પરિબળ  
છે. ચિંતા કરનારી વ્યક્તિ આખી રાત સ્વખમાં  
ક્યાંય ને ક્યાંય ઘૂમતી રહે છે. એના અજાગ્રત  
મનમાં રહેલી ચિંતાઓ ડરામણા કે લોભામણા  
સ્વખ ઉપે પ્રગટ થતી હોય છે. આવી વ્યક્તિની

નિદ્રા હરાઈ જાય છે અને પરિણામે રોગ અના શરીરમાં ધર કરે છે. કેટલીક વ્યક્તિઓ આ ચિંતા દૂર કરવા માટે જે પ્રયાસ કરે છે તે યોગ્ય હોતા નથી. જેમ કે કોઈ એક પ્રશ્નની ચિંતા હોય તો અને ભૂલવા માટે કોઈ મનોરંજનના સાધન પાસે જાય છે. બને છે એવું કે એ મનોરંજન સમયે પણ પેલી ચિંતા તો અના ભીતરમાં સળવળ્યા કરતી હોય છે. સિનેમા કે ટેલિવિઝન પૂર્ણ થતાં ફરી પાછી એ ચિંતા અના મન પર સવાર થઈ જાય છે.

મનના ઘોડા પર ચિંતા એક એવો સવાર  
છે કે જે સહેલાઈથી નીચે ઉત્તરતો નથી અને  
જો યોગ્ય રીતે એને નીચે ઉત્તારવામાં આવે  
નહીં તો, સતત કનઢતો અને પજવતો રહે છે.  
આવી ચિંતાને કારણો બ્યક્ઝિતના ઉત્સાહ પર ઠંડું  
પાણી રેડાય છે અને સમય જતાં ચિંતા એ  
એના જવનની પ્રગતિના પ્રવાહને અવરોધક  
મોટી શિલારૂપ બની જાય છે.

पर्यावरण

- પર્ણમાલેન શાહ

અમૃતના બુંદબુંદથી છલકે, વચનામૃત શ્રુતધાર છે,  
પરમગુરુની પાવનવાણીનો, એ પરમ ટંકાર છે.  
  
સાગર છલકે શુદ્ધ સ્વરૂપનો, રત્નત્રયી દાતાર છે,  
વીતરાગતાના મોતી નીખરે, વિશુદ્ધતા અપાર છે.  
  
જિનવાણીના નાદથી ગુંજતો, એક અપૂર્વ આધાર છે,  
ચતુર્ગતિના દુઃખને છેદતો, પંચમપદ દાતાર છે.  
  
મળતું સુખ જે આ સંસારે, એ તો સુખનો ભાસ છે,  
વચનામૃતના શબ્દે શબ્દે સાચા સુખનો વાસ છે.  
  
આત્મતત્ત્વની પ્રાપ્તિ એ તો માનવભવનો સાર છે,  
અમૃતબુંદના પાન થકી, સફળ કરવો અવતાર છે.

શ્રી પદ્મનંદિ આચાર્ય રચિત  
‘એકત્વસત્તત્વ’નું આચમન (કમાંક-૬૭)

પ્રા. ચંદાબહેન વી. પંચાલી (બોટાદ) 

પરમહૃપાળુ દેવ ‘વચનામૃત’ અમર ગ્રંથના  
પત્રાંક ઉપર માં જગાવે છે, “કોઈ કોઈ દુઃખના  
પ્રસંગોમાં તેવું થઈ આવે. છે અને તેને લીધિ વૈરાગ્ય  
પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો  
એમ જ જગાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું  
ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત  
થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય  
છે. માટે મનનો કંટાળો જેમ બને તેમ શમાવવો  
અને ઉપાર્જન કર્યા ન હોય એવાં કર્મ ભોગવવામાં  
આવે નહીં, એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષદસ્તિ  
કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું  
એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે.”  
જ્ઞાની પુરુષો વારંવાર બોધે છે, “સંયોગોનો સ્વીકાર  
કરવો” જે જે ઘટના બને છે તે સપ્રયોજન છે. જે  
જીવે જેવી કેસેટ ભરી હોય તેવી જ વાગે છે. બીજાના  
શર્જદો - કર્મો આપણી કેસેટમાં ભેણાઈ જતાં નથી.

શલોક ૬૬ માં આચાર્યશ્રી પ્રકાશે છે કે સામ્યભાવ શ્રેષ્ઠ કાર્ય છે - ઉત્કૃષ્ટ તત્ત્વ છે. સર્વ ઉપદેશોનો સાર સામ્યભાવ છે. કારણ કે સામ્યભાવથી જીવ મુક્તિ પામે છે.

આ સામ્યભાવને દૃઢ કરવા માટે શ્લોક હે  
માં કહું છે કે સંપૂર્ણ શાસ્ત્રોનો સાર સામ્યભાવ છે  
- તથા શ્લોક હે માં સામ્યભાવ શુદ્ધ આત્માનું  
સ્વરૂપ છે તેમ સમજાવ્યું. શ્લોક હે માં સામ્યભાવને  
વિશેષ દૃઢ કરે છે.

साम्यं शरण्यमित्याहुर्योगिनां योगगोचरम् ।  
उपाधिरचिता शेषदोषक्षापण कारणम् ॥

અર્થાત્તુ સામ્યભાવ શરણરૂપ છે. જે યોગીઓના યોગનો વિષય છે તથા ઉપાધિથી ઉત્પત્તિ

થયેલા સમસ્ત દોષોનો નાશ કરનાર છે.

જ્યારે જ્યારે જીવ પાંચ ઈન્ડ્રિયોના વિષય -  
વિકારમાં રસલુભ્ય બને છે, વિભાવ પરિણામોમાં  
બેંચાય છે ત્યારે પ્રત્યેક આત્માએ સમતાભાવને ધરી  
રાખવો એ જ કર્તવ્ય છે. એવો અનંત જ્ઞાનીઓનો  
બોધ છે.

સામ્ય શરણમ् - સદા સર્વદા સમતાભાવ  
શરણરૂપ છે. માંગલિક પાઠમાં ચત્તારી મંગલમ् -  
ચત્તારી લોગુત્તમા તથા ચત્તારી શરણમ् માં ચાર  
શરણરૂપ છે. અરિહંત શરણરૂપ છે. સિદ્ધ ભગવાન  
શરણરૂપ છે. સાધુ-મહામુનિરાજ શરણરૂપ છે તથા  
કેવળી પ્રરૂપિતધર્મ શરણરૂપ છે. અરિહંતપ્રભુ ત્યારે  
કહેવાય છે જ્યારે સમતારસ નિમગ્ન થયા. સિદ્ધ  
ભગવાન સામ્યભાવને પામ્યા ત્યારે આષકર્મ મુક્ત  
થયા. સાધુ-મુનિરાજની મહાનતા સમદર્શિતામાં છે.  
જૈનદર્શન સર્વજ્ઞ દર્શનરૂપે પ્રસિદ્ધ છે. કેવળી પ્રરૂપિત  
ધર્મ - સમભાવના શરણને સર્વભાવથી સ્વીકારે છે.  
આચાર્ય પદ્માંદિદેવ સામ્ય શરણમ् માં લોકોત્તર  
દાસ્તિ સ્થાપિત કરે છે. સામ્યભાવ આત્માશ્રિત ભાવ  
છે. ચૈતન્યદેવના શરણે સમતાભાવ હોય છે.  
સમતાભાવનું શરણ એટલે નિજ ચૈતન્યનું શરણ.  
રાગ અને દેખના દાનદનો અભાવ છે, માત્ર આત્મૈક્ય  
ભાવ જીવંત છે. અસ્તિત્વનું નિત્યનર્તન છે.

साम्यं योगिनां योगगोचरम् - आत्मयोगीओनो आत्मयोगनो विषय समताभाव છે. કર्मયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ, પૂર્ણયોગ વગેરે અનેક યોગદર્શન પ્રસિદ્ધ છે. અત્ર શ્રી પચનંદિ આચાર્ય યોગીઓના યોગના વિષય તૃપે આત્મયોગને પ્રકાશિત કરે છે. યોગીઓનું સત્ય

જોડાણ સામ્યભાવમાં છે. જે યોગી અષ્ટાંગ-યોગ-યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિને વિષય બનાવી જીવન જીવે છે તેના આધારમાં અંતે સમાધિભાવ જ ચરમસ્થાને છે.

શ્રી રમણ મહારિ આત્મયોગને વિષય બનાવે છે ત્યારે શ્રી અરવિંદ - પૂજાયોગને કેન્દ્રમાં સ્થાપે છે. શ્રીમદ્ ભગવદ્ગીતા કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગથી સમતાભાવને પુષ્ટિ આપે છે. શ્રી વિનોભાભાવે સમભાવને વિષય બનાવે છે. જેમ અનેક ઝરણા - નાની નદીઓ મહાસાગરને અંતે મળે છે તેમ બધા જ યોગના આધારમાં સાખ્યભાવ સહજાધાર થાય છે.

સિદ્ધાન્ત ચક્રવર્તી શ્રી નેમિયંડ આચાર્યદ્વારા -  
શ્રી ગોમ્મટસાર - જીવકંડમાં સામાયિક વિષે દર્શાવે  
છે કે સાધ્યગુર્દર્શન પછી પોતે જ્ઞાયક અને પોતે  
જ્ઞેયરૂપ થઈ, પોતાના આત્મા સિવાય સર્વ  
પરદ્રવ્યોથી પોતાનો ઉપયોગ હઠાવી પોતાના જ્ઞાતા-  
દૃષ્ટારૂપ આત્મસ્વરૂપમાં જ એકરૂપ થઈ આત્માને  
પોતાના ઉપયોગનો વિષય બનાવવો, અથવા રાગ-  
દ્વેષને હઠાવી, સમભાવ પ્રાપ્ત કરી મધ્યસ્થ ભાવરૂપ  
આત્મામાં લીન થઈ ઉપયોગની પ્રવૃત્તિમાં સમાઈ  
જવું એવું જેનું પ્રયોજન છે તે સામાયિક છે.  
સાધ્યભાવ તે ચૈતન્ય ચિંતામણી છે.

**સામ્યભાવ: દોષક્ષપણ કારણમ् - ઉપાધિથી**  
 ઉત્પન્ન થયેલા સમગ્ર દોષોનો નાશ કરનાર  
 સામ્યભાવ છે. પૂ. શ્રી સોભાગભાઈને  
 પરમકૃપાળુદેવ પત્ર દ્વારા (પત્રાંક-૩૨૪) સૂક્ષ્મબોધ  
 આલેખે છે, “ચોતરફ ઉપાધિની જવાલા પ્રજવલતી  
 હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્ટ છે,  
 અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે.  
 અમને પણ આશ્ર્ય થઈ આવે છે, તથાપિ એમ  
 પ્રાયે વત્ત્યાજ કરે છે, એવો અનુભવ છે. આત્મભાવ

યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાવિ પ્રાપ્ત હોય છે. સમ્યકૃદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાહીએ છીએ; અને તેવો અનુભવ છે.”

સમતાભાવરૂપી અમૃતના સંગે ઉપાયિથી  
ઉત્પણ થયેલા સમસ્ત દોષો નાચ થાય છે.  
વીતરાગતાને પ્રામ થતાં ઉપાયિ હોવા છતાં નિરુપાયિ  
સ્વરૂપ આત્મા અનુભવાય છે. એવી પરમ શ્રેષ્ઠતા  
સામ્યભાવમાં સૂક્ષ્મપણે સંગ્રહાયેલી છે.  
વીતરાગદશાને વરેલા જ્ઞાની ભગવંતો સમતારૂપી  
ચૈતન્ય ગુફામાં આનંદની કેલી કરે છે.

પૂ. બેનશ્રી ચંપાબેનના વચ્ચનામૃત ગ્રંથના  
 ૧૭૬ વચ્ચનામૃતમાં દર્શાવે છે કે મુક્તાદશા  
 પરમાનંદનું મંદિર છે. તે મંદિરમાં નિવાસ કરતાં  
 મુક્ત આત્માને અસંખ્ય પ્રદેશો અનંત આનંદ પરિણામે  
 છે. આ મોક્ષદૃપ પરમાનંદમંદિરનો દરવાજો  
 સાભ્યભાવ છે. જ્ઞાયકભાવે પરિણામીને વિશેષ  
 સ્થિરતા થવાથી સાભ્યભાવ પ્રગટે છે. જ્ઞાની  
 મહાત્માઓ એક સાભ્યભાવને સર્વોત્કૃષ્ણ  
 પરમભાવથી સ્વીકારે છે. અન્ય ઉપર દોષારોપણનો  
 ભાવ ઉદ્ય પામતો નથી. સમભાવથી સર્વ કર્માને  
 નષ્ટ કરી સિદ્ધત્વ પ્રાપ્ત કરી રહ્યા છે, કરી ગયા છે  
 અને ભાવિકાળમાં સિદ્ધત્વને પ્રાપ્ત થશે.

પરમકૃપાળુદેવ પત્રાંક-૩૪૧ માં ફરમાવે છે,  
 “અમને તો ગમે તેમ હો તોપણ સમાધિ જ રાખ્યા  
 કરવાની દંદતા રહે છે. પોતાને જે કંઈ આપત્તિ,  
 વિટેબના, મુંજવણ કે એવું કંઈ આવી પડે તેને માટે  
 કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઈચ્છા થતી  
 નથી. તેમ પરમાર્થદિષ્ટાને જોતાં તે જીવનો દોષ છે.  
 વ્યાવહારિક દિષ્ટાને જોતાં નહીં જેવો છે, અને જીવની  
 જ્યાં સુધી વ્યાવહારિક દિષ્ટા હોય છે ત્યાં સુધી  
 પારમાર્થિક દોષનો જ્યાલ આવવો બહુ દાઢુર છે.”

(卷之二)

## બાર ભાવના - એક અનુચિંતન

(કમાંક - ૨)

＊＊＊＊＊ પૂજય બહેનશ્રી ડા. શર્મિષ્ઠાબેન સોનેજી ＊＊＊＊

પરમદૂપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી વ.પ. -  
૨૫૪ માં મુમુક્ષુતા વિષે જણાવે છે, 'મુમુક્ષુતા' તે  
છે કે, સર્વ પ્રકારની મોહાસક્તિથી મુજાઈ એક  
'મોક્ષ' ને વિષે જ યત્ન કરવો." આપણે પણ આવા  
જ મુમુક્ષુ બનવું છે. મોક્ષરૂપી મહેલ ઉપર ચઢવા  
માટે વૈરાગ્યની જનની એટલે આનંદની જનની  
એવી આ બાર ભાવનાઓ નિસરણીના પગથિયા  
સમાન કહી છે. આ અંકમાં આપણે પ્રથમ એવી  
અનિત્ય ભાવનાની વિચારણા કરીશું.

### અનિત્ય ભાવના વિષે મહાપુરુષોની થોડી રચનાઓ...

- વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ,  
આયુષ્ય તે તો જળના તરંગ;  
પુરંદરી ચાપ અનંગ રંગ,  
શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !  
- શ્રી 'ભાવનાબોધ' - શ્રીમદ્ રાજચંદ્ર
- રાજા રાણ છત્રપતિ હાથિન કે અસવાર /  
મરના સબકો એક દિન અપની અપની બાર //  
- કવિવર શ્રી ભૂધરદાસજી
- આયુ ઘટત તેરી દિન રાત,  
હોય નિચીત રહ્યોં ક્યોં ભ્રાત ?  
જીવન ધન તન કિંકર નારિ,  
સબ હૈ જલ બુદ્બુદ ઉનહારી //  
- કવિવર શ્રી બુધજનજી
- જોબન ગૃહ ગો ધન નારી,  
હય, ગય જન આજાકારી /

ઇન્દ્રિય - ભોગ છિન થાઈ,  
સુરધનુ ચપલા ચપલાઈ //  
- કવિવર શ્રી દૌલતરામજી - છહ્યાલા  
● ઝૂઠે જગ કે સપને સારે,  
જૂઠ્રી મન કી સબ આશાયે /  
તન-જીવન-યૌવન-અસ્થિર હું,  
ક્ષણભંગુર પલ મેં મુરજ્જાએ //

- 'યુગલ' પંડિત શ્રી જુગલકિશોર
- દ્વબ્ય રૂપ કર સર્વથિર, પરજય થિર હૈ કૌન /  
દ્વબ્યદૃષ્ટિ આપા લખો, પરજય નય કર ગૌન //  
- પં. કવિવર શ્રી જયચન્દ્રજી છાબડા
- આ પ્રમાણે આપણે થોડી રચનાઓ જોઈ.  
આચાર્યપ્રવર શ્રી કુંદુંદસ્વામી તથા બીજા અનેક  
આચાર્યો તથા મહાપુરુષોએ બાર-અનુપ્રેક્ષાઓની  
રચના કરી છે - જેથી કરીને આપણને તેના અનિત્ય  
માહાત્મ્યનો જ્યાલ આવે છે.

ઉપરોક્ત રચનાઓના આધારે આપણે  
'અનિત્ય ભાવના' વિષે સરળ ભાષામાં વિચારીએ  
- ચિંતવન કરીએ.

શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક  
સર્વ વિનાશી છે. જીવનો (આપણો) મૂળ ધર્મ  
અવિનાશી છે, એમ ચિંતવનું તે અનિત્ય ભાવના.  
સંસાર, શરીર અને ઇન્દ્રિય વિષયોના ભોગથી  
પ્રાપ્ત થતાં ક્ષણિક, નાશવંત સુખાભાસનો વારંવાર  
વિચાર કરીને તે પ્રત્યે ઉદાસી થવું તે અનિત્ય  
ભાવના.

## સંસાર વિષે વિચારણા

વિશ્વના સર્વ જીવો - નાના જંતુથી માંડી  
મદોન્મત હાથી સુધી સર્વ પ્રાણીઓ, માનવીઓ,  
દેવદાનવો સૌ સુખ અને આનંદ ઈચ્છે છે અને તે  
પ્રાપ્ત કરવા અજ્ઞાનને લીધે વિભ્રમ પામી જ્યાં  
સુખ નથી એવા આ સંસાર અને સંસારના  
પદાર્થોમાં સુખ મેળવવાનો વ્યર્� પુરુષાર્થ કરે છે.  
તે વિષે મહાપુરુષો કહે છે :

- સંસારીનું સુખ એવું, જાંજવાના નીર જેવું,  
તેને તુચ્છ કરી ફરીએ રે .... મોહન ઘારા  
- ભક્ત કવિયત્રી મીરાંબાઈ
  - સુખ નહિ સંસારમાં, રાજી પ્રજાને રંક,  
કહે ‘પ્રીતમ’ વૈરાગ્ય વિના, નર નહિ હોય નિઃશંક.  
- કવિ શ્રી પ્રીતમદાસજી
  - સંસારની બધી વસ્તુઓ જ્યારે અનુભવના  
ત્રાજવે તોળવામાં આવી ત્યારે નકામી નીવડી  
એટલે તે નિઃસાર પ્રતીત થઈ. એક માત્ર  
આત્મજ્ઞાન જ હદ્યને આનંદદાયક નીવડ્યું.  
માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અને આત્મામાં  
સ્�િર રહેવું તે જ મનુષ્યનું સૌથી પ્રથમ અને  
સૌથી મહત્ત્વનું કાર્ય છે.
  - અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન ભિત્રતા !  
અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !!  
ઉધાડ ન્યાયનેત્રને નિહાળ રે ! નિહાળ તું;  
નિવૃત્તિ શીଘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.  
- શ્રીમદ્ રાજચંદ્રજી
  - “સંસરણાં સંસાર: પરિવર્તનમ્” સંસાર તે છે  
કે જ્યાં જીવ સંસરણ - ભ્રમણ કરે છે. તે એક  
અવસ્થા છોડી ફરી બીજી અવસ્થાને ધારણ  
કરે છે. સંસારમાં સ્થિરતા નથી, ધ્રુવતા

(નિત્યતા) નથી, નિરાકૃષ્ટતા નથી, સંસાર દુઃખનો સમુદ્ર છે.

- શ્રી સહજસુખ સાધન

- સંસારના સુખો અનંતીવાર આત્માએ ભોગવ્યાં છતાં તેમાંથી હજુ મોહિની ટળી નહીં અને તેને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે; કારણ સંસાર કડવો છે, કડવા વિપાકને આપે છે; તેમ જ વૈરાગ્ય એ કડવા વિપાકનું ઔષ્ઠ છે; તેને કડવો ગણ્યો; આ પણ અવિવેક છે.

- શ્રી મોક્ષમાળા-૫૧, શ્રીમદૃ રાજચંદ્રજી

શરીરનું સ્વરૂપ

- દેહ અચેતન પ્રેત દરી,  
 ૨જરેત ભરી મળ ખેતકી ક્યારી,  
 વ્યાધિકી પોટ, અરાધિકી ઓટ,  
 ઉપાધિકી જોટ, સમાધિ સો ન્યારી;  
 રે જ્ય દેહ કરે સુખ હાનિ  
 ઈતે પર તોહિ તો લાગત ઘારી,  
 દેહ તો તોહ્યી ત્યજેંગી નિદાન પૈ.

- પં. બનારસીદાસજી ‘શ્રી સમયસાર નાટક’

- ਇਸ ਤਨ ਧਨ ਕੀ ਕੌਨ ਬਡਾਈ,  
ਦੇਖਤ ਨਧਨੋਮੇ ਮਿਛੀ ਮਿਲਾਈ,  
ਹਾਡ ਜਲੇ ਜੈਸੇ ਲਕਡੀ ਕੀ ਮੋਲੀ,  
ਬਾਲ ਜਲੇ ਜੈਸੇ ਘਾਸ ਕੀ ਪੋਲੀ... ਇਸ

- ਮਾਣਸਾ ਕੁਭੀਰਵਾਸ਼ਿ

ਅਵਤ ਸ਼੍ਰੀ॥ ਤੈਥੇ

- ધરે અબ ધીર કેસે, બીતત તમામ હૈ,  
જિંદગી સુધાર બંદે યહી તેરો કામ હૈ,  
- સ્વામીશ્રી બ્રહ્માનંદજી

- बालापन खेलन मे खोयो, जोबन मोहो नार,  
बुद्धापन तन जरजर होवे, मन तृणा विस्तार.  
अब तो छोड जगत की लालसा रे,

सुमरो सर्जनहार ।

- स्वामी ब्रह्मानंदजी

- देह तारी नथी, जो तुं जुगते करी,  
राखतां नव रहे निश्चे जाये,  
देह संबंध तजे अवनवा बहु थाशे,  
पुत्र कलत्र परिवार व्याये.  
- भक्तकवि नरसिंह महेता

### शरीर संबंधी दुःखो

- जन्म जरा ने मृत्यु, मुख्य हुःखना हेतु;  
कारण तेना बे कल्यां, रागद्वेष अशहेतु.  
- श्रीमद् राजचंद्रज्ञ
- विचार विनाशी शरीर सगाई,  
मात पिता खी धन, सुत भाई,  
वांछे छे ज्व अतिशय आने,  
मूळ मरण देखे नहि शाने ?
- रोग, अशक्ति, भूख, तरस, ठंडी, गरभीथी  
कष पामवुं, बीजा तिर्यच आहि तथा मनुष्यो  
द्वारा त्रास पामवो ए बधा शरीरना हुःखो  
छे.

### मन संबंधी दुःखो

आपणे मनुष्योनिमां छीअे एटले मन  
सहित छीअे. मन होवाने लीधे आपणे आधि,  
व्याधि अने उपाधि ऐम त्रिविध तापथी संसारमां  
बणी रह्या छीअे. रागद्वेषने लीधे आकुणता,  
ईष्वियोग अने अनिष्टना संयोगथी शोक अने  
भेद अनुभवीअे छीअे. अधिक धनादि संपत्तिना

परिग्रहनी तृष्णा तथा कोध, मान, माया, लोभ  
आपणने घणी आकुणता अने अशांति करावे छे.

### भोगोनुं स्वरूप

- सोचा करता हूँ भोगों से,  
बुझ जायेगी इच्छा ज्वाला,  
परिणाम निकलता है लेकिन,  
मानो पावक में घी डाला ।  
- पंडित श्री जुगल किशोर  
- देवशास्त्रगुप्तजा की जयमाला
- काम भोग प्यारा लगे, फल किपाक समान,  
मीठी खाज खुजावतां, पीछे दुःख की खान ।  
- श्री बृहद आलोचना
- भोग एटले ईन्द्रियो द्वारा प्राप्त थतुं  
विषयोनुं सुख केवुं छे ते विषे आचार्यवर  
कुण्डकुण्डस्वामी कहे छे :-  
● परयुक्त बाधासहित, खंडित, बंध कारण, विषम छे;  
जे ईन्द्रियोथी लब्ध ते सुख, ए रीते हुःख ज खरे.  
- श्री प्रवचनसार-७६

**भावार्थ :** ईन्द्रियो द्वारा प्राप्त थतुं सुख ते  
भरेखर हुःख ज छे - कारण के (१) ते सुख  
पराधीन छे, (२) विघ्नवाणुं छे, (३) ते सुख  
क्षणिक छे, (४) ते आपणने अशुभकर्मोनो बंध  
करावे छे, (५) ते सुख आकुणतावाणुं छे.

परमकृपाणु देव श्रीमद् राजचंद्रज्ञ  
परमकरुणा करीने आपणने शाश्वत सुखनो बोध  
आपे छे,

“हे ज्व, तुं भमा मा, तने हित कहुं छुं.  
अंतरमां सुख छे. बहार शोधवाथी मणशे नहां.  
अंतरनुं सुख अंतरनी समश्रेष्ठीमां छे; स्थिति  
थवा माटे बाह्य पदार्थोनुं विस्मरण कर,

આશ્વર્ય ભૂલ.”

- શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૦૮

## સંસારના પદાર્�ોનું સ્વરૂપ :

- જલબુદ્ધબુદ્ધ સમ છે તનુ, લક્ષ્મી ઈન્ડ્રાધનુષ જેવી જાણો, તીવ્રપવનહત મેધપટલસમ, ધન, કાંતા, સુત પરિમાળો; મતમાનિની-કટાક જેવું વિષયસુખ છે ચેપળ સદા, તેથી તેની હાનિ પ્રાપ્તિમાં શોકથી શું કે શું મુદા ?
  - આત્મા દ્વાર્યે નિત્ય છે, પદ્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, શાન એકને થાય.

- श्री आत्मसिद्धिशास्त्र

આ પ્રમાણે જે જે જગતમાં દેખાય છે તે  
સધણું નાશવંત છે - ક્ષણિક છે - બદલાતું રહે છે.  
એક માત્ર જીવ (આત્મા-આપણું મૂળ સ્વરૂપ) તે  
જ અવિનાશી પરમતત્વ છે.

- સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ,  
દેહવિનાશી, હું અવિનાશી, આનંદધન હું આત્મા,  
દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર પદ માહુરું.

અનિત્ય (અધ્યુવ) ભાવનાનું નિશ્ચયથી  
ચિંતન આ પ્રમાણે કરવું કે - પરમાર્થથી  
જ્ઞાનાનંદસ્વરૂપ આ આત્મા ("હું") દેવ - અસુર  
અને નરેન્દ્રના વૈભવોથી ને શરીરાદિ (મન, વાણી  
તથા વિભાવ ભાવો) પરપદાર્થથી તદ્દન વિભિન્ન,  
ત્રિકાળશુદ્ધ તેમજ શાશ્વત પરમ પદાર્થ છે.  
તત્ત્વજ્ઞાનપૂર્વક તેની ભાવ અનુપ્રેક્ષા કરવાથી  
શાશ્વત સિદ્ધગતિ પ્રાપ્ત થાય છે.

જેમ જેમ અનિત્ય ભાવના દૃઢ થતી જાય છે તેમ તેમ આપણી શરીર અને જગતના ચેતન-અચેતન પદાર્થો પ્રત્યે મોહાસક્તિ ઘટતી જાય છે તથા સમ્યગુદર્શન પ્રગટાવવાની સત્તુપાત્રતા વર્ધમાન થતી જાય છે.

અંતમાં અનિત્ય ભાવનાને દૃઢ કરાવનારા  
અવતરણો -

- પ્રિયદેહને સ્નેહીજનો, સામ્રાજ્ય મોટા આદિને, ધન રૂપ, બળ ને પુણ્ય વિભૂતિ યોગ સૌં અધ્યવ છે; વિભિન્ન સૌથી શાશ્વતો નિજ એક આત્મા શ્રેષ્ઠ છે, ભવભીત ભવિ તો એમ ભાવે ભાવના અધ્યવ એ.

- શ્રી સોભાગયંદ ચૂ. શાહ  
(આલોચનાટિ પદ સંગ્રહ - અગાસ)

- છો ખંડના અવિરાજ જે ચંદે કરીને નીપજ્યા,  
બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા;  
એ ચતુર ચક્કી ચાલિયા હોતા નહોતા હોઈને,  
જન જ્ઞાનીએ મન માનીએ નવ કાળ મફે કોઈને.

- શ્રીમદ રાજચંદ્રજી

- जो दीखे इन नैन सों, सो सब विनस्यो जाय,  
तासों जो अपनो कहे, सो मरख सिरराय ।

- भैया भगवतीदास

॥ श्री सद्गुरुयरणार्पणमस्तु ॥

સંકલન : એક મુમુક્ષુ  
કીનીક્ષા (USA)

સ્વને જાણા, પર તરફની ખાણા, એ જ સત્ય પ્રમાણા.  
સ્વને નમ, પરને વમ, એ જ સાચી ગમ.  
ટૂંકુંને ટચ, સ્વમાં રચ, પરથી બચ.  
સ્વનો શોખ, પરનો શોક, કરે કર્મને ફોક.  
સ્વ અમૃતજળ, પર મૃગજળ, બની જા વીરબાળ.  
સ્વમાં રહ્મ, પર કર્મ, સાચો આધ્યાત્મિક ધર્મ.  
સ્વ છે અપૂર્વ, પર છે ગર્વ, સાચા સિદ્ધ સર્વ.  
સ્વમાં વસ, પરથી ખસ, એ ટલું બસ.

100

## શ્રી આનંદધન ચોવીશી

**અશોકભાઈ પી. શાહ**

### ૮ મા તીર્થકર શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન

**ભૂમિકા :** યોગીશ્વર આનંદધનજીના સ્તવનોમાં ભક્તિસભર જ્ઞાનરસ છે કે જ્ઞાનસભર ભક્તિરસ, એ કહેવું મુશ્કેલ છે. પરંતુ ચોવીશીના એક પછી એક સ્તવનોનું રસપાન કરતાં ભક્તિરસનું પલ્લું વધારે ઝુક્તું હોય એવું લાગે - પણ હા, મુક્તિ તરફ સહજપણે ખેંચી જતો એ ભક્તિરસ છે ! સ્તવનોમાં રહેલ તત્ત્વને સમજીને ભાવપૂર્વક પારાયણ કરીએ તો આપણને પણ પ્રભુપ્રેમ તરફ ખેંચી જાય એવું તેમાં હૈવત છે. આપણા સ્વચ્છંદ અને અહંકારને તોડવા આવી તાત્ત્વિક ભક્તિ સિવાય બીજો શું ઉપાય હોઈ શકે ? કારણ કે, પ્રભુનું, સદગુરુનું દાસત્વ સ્વીકારવારૂપ ભક્તિમાં પરમ વિનયગુણની આરાધના છે, જે અહંકારના પડળોને દૂર કરી ભીતર રહેલા શુદ્ધાત્માને પ્રકાશમાં લાવે છે.

**ऋઘભ જિનેશ્વરને પ્રીતમ બનાવ્યા પછી,** અજિતનાથ સ્તવનમાં તેમનો પંથ નિહાળવાની તાલાવેલી તો સંભવનાથ સ્તવનમાં તેમની સેવા કરવાની પારમાર્થિક વિધિ, અભિનંદન સ્તવનમાં પ્રભુદર્શનની ખાસ, સુમતિનાથ સ્તવનમાં તેમના ચરણમાં આત્મઅર્પણિતા, પદ્મપ્રભુ સ્તવનમાં પ્રિયતમ સાથે અંતર ઘટાડી એકમેક થવાની ભાવના અને સુપાર્શ્વનાથ સ્તવનમાં વિવિધ નામસ્મરણ દ્વારા ગુણગાન - આમ, કોઈને કોઈ રીતે પ્રભુદર્શનના 'દર્શન પરિષહ' ની અભિવ્યક્તિ કરતાં કરતાં આનંદધનજીની દર્શનાભિલાષા એટલી તીવ્ર બનતી જાય છે કે હવે તેઓ ચંદ્રપ્રભુના

દર્શન માટે જાણે ઘેલા બની પોતાની 'સુમતિ' રૂપ સખીને તે માટે સહાય કરવા વિનંતી કરે છે. સાથે સાથે ચોરાશી લાખના સંસાર પરિબ્રમણમાં કઈ રીતે પ્રભુદર્શનથી વંચિત રહી ગયા તેનો ચિતાર Flashbackની જેમ આપે છે. આ જાણે આપણા જ પરિબ્રમણની રામકલાની હોય તેવો અનુભવ કરાવી, આ મળેલ મનુષ્યભવનો અવસર ન ગુમાવી પ્રભુદર્શનની તીવ્ર અભિલાષા જગાડતાં સાવનનો પ્રારંભ કરતા કહે છે :

દેખણ દે રે સખી, મુને દેખણ દે,  
ચંદ્રપ્રભ મુખચંદ, સખી  
ઉપશમ રસનો કંદ સખી,  
સેવે સુર નર ઈંદ, સખી.

**ગત કલિમલ દુઃખ દ્વંદ્વ સખી. મુને. ૧**

**શબ્દાર્થ :** હે સખી ! મને ચંદ્રપ્રભુના મુખચંદ્રને જોવા દે, જોવા દે ! જેઓ ઉપશમરસના કંદ છે, જેમના સર્વ કર્મમળનો અને સુખ-દુઃખ આદિ દ્વંદ્વોનો નાશ થયો છે, જેમને ઈન્દ્ર-નરેન્દ્ર સેવે છે, એમના દર્શન, હે સખી ! મને કરી લેવા દે. (દેખણ દે = જોવા દે, દર્શન કરવા દે; સખી = સુમતિરૂપ સખી; મુખચંદ = ચંદ્ર જેવું મુખ; ઉપશમરસ = શાંતપણું, શાંતરસ, કષાયરહિતપણું; કંદ = મૂળિયું; સુર = દેવ; નર = મનુષ્ય; ઈંદ = ઈંદ્ર; ગત = ગયા છે, નાશ પાખ્યા છે; કલિમલ = કાદવનો મેલ, કર્મરૂપી મેલ; દ્વંદ્વ = સુખ-દુઃખ, પાપ-પુણ્ય આદિ જોડકાં)

**ભાવાર્થ :** આનંદધનજીએ જ્યારથી ઋઘભ જિનેશ્વરને પ્રીતમ બનાવ્યા ત્યારથી સ્વાભાવિક રીતે જ તે સ્વરૂપે બિરાજમાન સર્વ તીર્થકરોનો

તેમાં સમાવેશ થઈ ગયો. તેથી એક નવોઢા સ્વીને  
જેમ પોતાના પતિદેવને મળવાની અપાર ઘેલણા  
હોય છે, તેમ આનંદધનજી હવે પોતાના પ્રિયતમ  
પરમાત્મા શ્રી ચંદ્રપ્રભુ ભગવાનના દર્શન કરવા  
માટે અત્યંત આતુર થયેલા અહીં જાણાય છે.  
“દેખણ દે રે સખી, દેખણ દે” - મને જોવા દે,  
હે સખી, મને જોવા દે ! એમ બે વખત ભાર  
દઈને ચંદ્રપ્રભુનું મુખદું જોવા માટે અધીરાઈ બતાવે  
છે. પહેલાંના જમાનામાં જ્યારે લાજ કાઢવાનો  
રિવાજ હતો ત્યારે નવવધૂ મોકો મળતાં લાજના  
એક ખૂણેથી પતિદેવનું થોડું દર્શન કરી લેતી ! એ  
જ રીતે આનંદધનજીને જે સ્વાનુભૂતિ થઈ છે તેમાં  
પોતાના પ્રિયતમ પરમાત્માની એક જલક તો જોઈ  
લીધી છે. તે સ્વરૂપની ભવ્યતા જોઈને ફરી ફરી  
તે દર્શન કરવા તેઓ તલપાપડ થઈ રહ્યાં છે.  
દુનિયામાં આપણે જોઈએ છીએ કે પ્રિયતમને  
મળવાની બહુ ઈચ્છા હોય ત્યારે સ્વી પોતાની  
સખીની મદદ લઈને તે કામ કરે છે. વળી, સખી  
સાથે બધી વાત ખુલ્લા દિલથી કરી શકાય. અહીં  
પરમાર્થમાર્ગમાં આનંદધનજીનો આત્મા પોતાની  
‘સુમતિ’ સખીની સહાય લઈને જાણે કહે છે, “હે  
સુમતિ ! તું મારી સખી બનીને મારો અને  
પરમાત્માનો મેળાપ કરાવી આપ !” સુમતિ એટલે  
સમ્યક્કમતિ, પ્રજ્ઞા, વિવેકપૂર્ણ મતિ, જેની સહાયથી  
પરમાત્મરૂપ શુદ્ધાત્માના દર્શન કરી શકાય છે.

એક સ્વી પોતાની સખીને સંબોધન કરે છે  
 એમ દર્શાવી આનંદઘનજી પોતાને પણ એક સ્વીરૂપે  
 કલ્યાને પ્રભુ પ્રત્યે પરમ દાસત્વભાવ પ્રગટ કરે  
 છે, કારણ કે પતિગ્રતા સ્વી તે દાસીપણાનું એક  
 ઉત્તમ પ્રતિક છે. નરસૈયો કહે છે તેમ : “ભલે  
 મળ્યા રે મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમસુખ  
 પામી, હારિનો રસ પૂરણ પાયો.” આવી

દાસત્વભક્તિ જ અહંકારનો સર્વનાશ કરીજ  
પ્રભુનો ભેટો કરાવે છે.

પરમાત્માની જે ઝલક આનંદધનજીને સ્વાનુભવ દ્વારા જોવા મળી છે, તે સ્વરૂપનું તેઓ વર્ણન કરતાં કહે છે - અહાહા ! કેવું અદ્ભુત છે મારા સ્વામીનું સ્વરૂપ ! ‘ઉપશમ રસનો કંઈ’ - તેમના સર્વાંગ આત્મપ્રદેશોમાંથી નિરંતર ઉપશમરસ, પરમ શાંતરસ જરે છે. કંઈ એટલે મૂળિયું, જેમાંથી ઉપશમરસ સમયે સમયે નવી નવી પર્યાયરૂપે જગ્ને છે. ‘ઉપશમ’ એટલે સર્વ કખાયો જ્યાં વિશેષ પ્રકારે શમી ગયા છે, ઘાતીકર્મોના સંપૂર્ણ નાશથી સર્વ કખાયનો આત્યંતિક અભાવ થવાથી જ્યાં આત્માના અનંત ગુણો સંપૂર્ણ શુદ્ધપણે ખીલી ઉઠ્યાં છે, વિકારનો અનંતાંશ પણ જ્યાં રહ્યો નથી અને પ્રતિપળ સ્વરૂપમાંથી ઉદ્ભવતા અનંત આનંદના ભોગવટાથી જ્યાં અત્યંત અત્યંત પરિતૃપત્યાં, સંતુષ્ટપણું વર્તે છે. આવો ઉપશમરસ બહાર આવી ચંદ્રપ્રભુના મુખચંદ્ર પર ઉપસી આવ્યો છે, જેના દર્શન કરતાં ભવ્યજીવોને નિજાત્માના દર્શન થાય છે. આવા ઉપશમરસને જ ‘સમાધિરસ’ નામ આપી ગણિશ્રી દેવચંદ્રજી મહારાજ શ્રી સુવિધિનાથ પ્રભુના દર્શન કરતા ભાવવિભોર થઈ બોલી ઉઠે :

ਫੀਂਦੇ ਸੁਵਿਧਿ ਕਿਣਾਂਦ, ਸਮਾਖਿਰਸੇ ਭਧੋਂ ਛੇ ਲਾਲ,  
ਆਸ੍ਥਾਂ ਆਤਮਸ਼ਵਦੁਪ, ਅਨਾਹਿਨੋ ਵੀਸਥੋਂ ਛੇ ਲਾਲ.”

આનંદધનજી પણ અહીં ભાર દઈને જ્યારે  
બે વાર ‘દેખણ દે’ બોલી ઉઠે છે, તેની પાછળનું  
આ જ પ્રયોજન છે કે પ્રભુદર્શનથી પોતાના  
સ્વરૂપના ઉપશમરસના ધૂંટ તેમને પસલી  
ભરીભરીને પીવા છે.

‘પ્રશામરસ નિમગ્નં દણ્ણિયુગમં પ્રસત્રં’ -  
એવા આ ઉપશામરસના કંદમાંથી વહેતા  
ઉપશામરસનું પાન કરીને પોતાને જે અનુભવ થયો  
તેની ખુશાલી દર્શાવતાં પંડિતપ્રવર શ્રી  
દૌલતરામજી પણ ‘દર્શનસ્તુતિ’ માં કહે છે :

અબ કાલલબ્ધિબલ તૈં દ્યાલ,  
તુમ દર્શન પાય ભયો ખુશાલ;  
મન શાંત ભયો મિટિ સકલ દ્વંદ્વ,  
ચાંદ્યો સ્વાતમરસ દુઃખનિકંદ.

પ્રભુ જોકે અનંત ગુણના ભંડાર છે, છતાં  
આ ઉપશામરસ એક એવો ગુણ છે, જે પ્રભુના  
સમસ્ત આંતરિક વીતરાળી વ્યક્તિત્વને તેમની  
મુખમુદ્રા ઉપર લાવીને અગમ્ય અને અગોચર એવા  
આત્મતત્ત્વને આપણા જેવા પામર જ્ઞાનો માટે પણ  
સુગમ અને અનુભવગોચર કરી આપે છે. નિરાકાર  
એવું આત્મસ્વરૂપ ચંદ્રપ્રભુના મુખચંદ્રમાંથી ઝરતા  
ઉપશામરસથી જાણે સાકાર બની બહાર આવે છે  
અને આપણને પણ આપણું મૂળ સ્વરૂપ કેવું સૌભ્ય,  
શાંત, નિર્વિકારી, આનંદમય છે તેની સમ્યક્ક  
પ્રતીતિ કરાવે છે. પ્રભુની નાસાગ્ર દણ્ણિવાળી  
મુખમુદ્રા પણ ઉપશામરસનું પ્રતિક છે. તેનાં દર્શન  
કરીને તે મૂળિયામાંથી ઉપશામભાવનું પોષણ કરીએ  
એવી પ્રેરણા આનંદધનજી કરી રહ્યા છે.

ઉપશામરસથી પ્રભુના મુખચંદ્રમાંથી નીતરતી  
શીતળતા તો ચંદ્રને પણ લજવે તેવી છે. ચંદ્રમાં તો  
હજુ થોડી કાલિમા છે, પરંતુ પ્રભુ તો ‘ગત  
કલિમલ’ - એટલે સર્વ કર્મરૂપી કાદવના મેલથી  
રહિત થયા છે - અને ‘દુઃખ દ્વંદ્વ’ - રાગ-દ્વેષ,  
સુખ-દુઃખ, રતિ-અરતિ, આદિ સર્વ દુઃખદાયક  
દ્વંદ્વોથી પાર થઈ દ્વંદ્વાતીત દર્શાને પાચ્યા છે. પ્રભુના  
આવા અચિત્ય સ્વરૂપ પ્રત્યેની ભક્તિને લીધે જ

‘સેવે સુર નર ઈંદ્ર’ - મનુષ્ય, દેવ, ઈંદ્ર, નરેન્દ્ર  
(ચક્રવર્તી) અને સર્વ ભવ્ય જ્ઞાનો પ્રભુની સેવા કરે  
છે, અર્થાત્ તેમની આજાનું આરાધન કરે છે,  
કારણ કે તેમને પણ પ્રભુના જેવાં જ ઉપશામરસનો,  
પરમશાંતિનો અનુભવ કરવો છે. આવા મનોહર  
પ્રભુના દર્શન થાય એવો કંઈક ઉપાય કર, અમ  
આનંદધનજી પોતાની ચિત્તવૃત્તિરૂપી સખીને  
સંબોધીને હવે કેવી કેવી માઠી ગતિઓમાં આ  
જ્ઞાન અનંતકાળ પરિભ્રમણ કર્યું તેનો ચિત્તાર આપી  
આપણાને મળેલ આ મનુષ્યભવની દુર્લભતા માટે  
જાગૃત કરવાના છે, જે યથા અવસરે અવલોકીશું.

(ક્રમશાસન)

### વિચારકણિકા

- તૃપ્તિનું સર્જન ઈંદ્રજાના વિસર્જન બાદ જ થાય છે.
- શત્રુ, આગ અને દેવું એ ત્રણને કદી નાના સમજવા નહીં.
- પોતાને વસ્તુ ન મળે તેનું દુઃખ થાય તે તો સમજય, પણ કોઈને વસ્તુ મળે તેનું દુઃખ આપણને શા માટે થાય છે - એ સમજાતું નથી.
- જે સમજથી દૂર જાય છે, તેને એક દિવસ સમજથી દૂર જવું પડે છે.
- રામાયણનું સર્જન સહકારથી થાય છે અને મહાભારતનું સર્જન તિરસ્કારથી થાય છે.
- તમામ જાતના દુઃખો અને સમસ્યાઓનું મૂળ અપેક્ષા છે.
- સાપનો સંપર્ક ફક્ત એક જન્મ જોખમી બને, પાપનો સંપર્ક તો જન્મોજન્મ જોખમી બને.
- કોણ્ણિંદું તો ફક્ત અંધારિયો ખૂણો જ અજવાણે છે, જ્યારે કરુણા તો અંધારિયા જવનને અજવાણે છે.

## અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?

(કમાંક - ૧૦)

**વલભજી હીરજી 'કેવલ'**

"શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,  
માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;  
જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા,  
ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ. ૧૦

અતે સમભાવની પરાકાણ કહી છે. શત્રુ મિત્ર બંને આત્મા, શક્તિપણે સિદ્ધ ભગવાન જેવા છે, તો હું કોના પર રાગ કે દેખ કરુ ? કોઈ પૂર્વના વેરને કારણે શત્રુ થઈને શરીરને ઉપસર્ગ કરે તો પણ દેખ નથી, તેથી વીતરાગભાવ છે. કોઈ મિત્ર હોય, શરીરની બધી સગવડતા પૂરી પાડે, એક વચ્ચનની આજ્ઞા સાંભળતા અનેક સગવડતા હાજર કરે, બહુ વિનય કરે તેવા મિત્ર પ્રત્યે પણ રાગીપણું નથી. એમ શત્રુ-મિત્ર પ્રત્યે સમદર્શિતા છે, તેથી કોઈ દુર્જનને સજજન માને એમ કહેવું નથી. પણ જ્ઞાનમાં જાણે કે તેની પ્રકૃતિની મર્યાદા તેટલી છે. શત્રુ-મિત્ર માન-અપમાનમાં સમભાવ પ્રગટે એવો અપૂર્વ અવસર ક્યારે આવશે ? એવી ભાવના ભાવી છે.

દેહનું આયુષ્ય લાંબુ હોય કે તેનો શીંગ અંત આવવાનો હોય, તે બંને સરખું છે. જીવન અને મૃત્યુ એ પુદ્ગલના અનંત રજકણોની અવસ્થા છે. તેનું મળવું, ગળવું, ટળવું તે પુદ્ગલને આધીન છે. તેને આત્મા ટકાવી શકે નહીં. ધર્મત્વા આ દેહ ધૂટવા ટાણે અપૂર્વ પુરુષાર્થથી સમાધિમરણે શાંતિ લઈ જાય છે. માત્ર મોક્ષ અભિલાષ જેને વર્તે છે અને સ્વરૂપના ભાનની જેને કિંમત છે તે સ્વરૂપની સાવધાનીથી સર્ફણ જીવન જીવે છે. દેહાયુષનો અંત દેખીને અપૂર્વ ભાવનાનો ધોંઘ તેને ઉછળે છે, શક્ષાનો પુરુષાર્થ સ્વરૂપની એકાગ્રતામાં તેને વર્તે છે. ભવનો

અભાવ કરીને તે જાય છે. આયુષ્યની સ્થિતિ પૂર્ણ થયે જે ક્ષેત્રે, જે કાળે, જેવી રીતે દેહનું ધૂટવું નિર્માણ થયેલ છે તેવી રીતે જ થાય છે, એક સમય માત્રનો પણ ફેર પડે નહીં. આત્માના જ્ઞાન સહિત પૂર્ણતાના લક્ષે સ્વરૂપ સ્થિતાની આ ભાવના છે. શત્રુ કે મિત્ર, નિંદક કે વંદકને સમ ગણે, જીવન-મૃત્યુને સમ ગણે. શાંતિ એટલે સમતા સ્વભાવ. હે પરમાત્મા ! તમે સિદ્ધ સ્વભાવ પ્રગટ કર્યો છે, હું પણ તમારા જેવો થવાનો હું એ લક્ષમાં રાખી શ્રીમદ્દ અહીં કહ્યું છે કે, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અહીં બેહદ સમતામય દ્રવ્ય સ્વભાવ અને વીતરાગતા કહી છે. ભવ પ્રત્યે ખેદ નહીં. એકાદ ભવ બાકી રહ્યો અથવા ભવનો અભાવ કર્યો તેમાં સંસાર કે નિઃસંસાર દશાનો શોક કે હર્ષ કરવાનો અવકાશ નથી. એવી અપ્રમત્ત ભૂમિકાથી લઈને આગળ ક્ષપક શ્રેણી માંડુ એવો એકલો વીતરાગભાવ ક્યારે આવશે ? તે ભાવના અહીં પ્રગટ કરી છે.

શુભ વિકલ્પ તોડીને એવી ઉત્કૃષ્ટ સ્થિતા - એકાગ્રતા કરું કે કેવળજ્ઞાનની પર્યાય ઉઘડી જાય, એમ ભાવના ભાવી છે તે પામવાની યોગ્યતા એટલે કે ઉત્કૃષ્ટ સાધકદશાનો આવો સમભાવ થાય ત્યાં મોક્ષદશ પ્રગટે જ. બંધ અને મોક્ષ એ બે તો અવસ્થા છે. આત્મા અવિનાશી નિત્ય છે. કર્મ-નોકર્મરૂપ પુદ્ગલની અવસ્થા ટળવાને નિમિત્તની અપેક્ષાએ મોક્ષ કહેવાય છે. ભવ અને મોક્ષ તે પર્યાયદિશિ. એ પર નિમિત્તના બે ભંગ છે. આત્મા તે બે ભંગની અવસ્થારૂપે નથી; કેમ કે તે કોઈ નિમિત્તની અપેક્ષા રાખતો નથી, પણ નિત્ય એકરૂપ છે. આત્મભાવપૂર્વક ચારિત્ર આવરણને ટળવા ઉગ્ર પુરુષાર્થની ભાવનાથી ઉગ્ર નિર્જરાભાવનું આ વર્ણન કર્યું છે. (કમશઃ)

## બિન્દુભાગ વિનાના બિખારી !

### ચંદ્રહાસ ત્રિવેદી

એક બિખારી એક દિવસ ગમે તેમ કરીને વહેલી સવારે અમેરિકાના અબજોપતિ ઓન્ડુ કાર્નેંગીના બંગલામાં ધૂસી ગયો અને તેમને મળવાની હઠ પકડીને બૂમાબૂમ કરવા લાગ્યો. પહેરાવાળા તેને ધક્કા મારે પણ તે બહાર જાય નહીં. વળી તેણે કહ્યું, “હું કાર્નેંગી સાહેબને વર્ષોથી ઓળખું છું. તમે તેમને બોલાવી આપો.” પહેરાવાળા વિચારમાં પડી ગયા. આ રક્જક ચાલતી હતી, ત્યાં શ્રી કાર્નેંગી તેમના બેઠક ખંડમાંથી બહાર આવ્યા.

પેલા બિખારીએ કાર્નેંગીને સલામ કરી પોતાની મુશ્કેલી જણાવી સો ડોલરની માગણી કરી. કાર્નેંગી કંઈ આ માણસને ઓળખતા હોય તેમ લાગ્યું નહીં. તેથી ચોકીવાળાઓએ તેને બાવડેથી જાલ્યો અને કહ્યું, “જુઢા, સાહેબ તને ક્યાં ઓળખે છે ?” બિખારીએ કહ્યું, “મેં એવું ક્યાં કહ્યું છે કે કાર્નેંગી સાહેબ મને ઓળખે છે ? મેં કહ્યું હતું કે હું તેમને ઓળખું છું. વર્ષોથી હું તેમને મોટી ગાડીમાં જતા આવતા જોઉં છું. મારી ઊભા રહેવાની ચોક્કસ જગા છે. અને હું સમય સાચવનાર માણસ છું. તેઓ મને ન ઓળખે તેમાં મારો વાંક કે તેમનો વાંક ?”

પહેરેગીરો બિખારીને ધક્કો મારી બહાર કાઢવા જતા હતા પણ ઓન્ડુ કાર્નેંગીએ તેમને રોક્યા. તેમને માણસ જરા મજાનો લાગ્યો. તેમણે બિખારીને કહ્યું, “તારી વાત સાચી છે. હું તને ન ઓળખું તેમાં તારો વાંક ન ગણાય. પણ હવે મને તું એ ખાતરી કરાવી શકીશ કે તું સાચો બિખારી છે અને તારી મુશ્કેલી પણ સાચી છે.”

બિખારીએ પોતાની પાસેની થેલીમાંથી થોડાક કાગળો ખેંચી કાઢીને કાર્નેંગીની સામે ધર્યા. તેમાં આ માણસનાં નામ-ઠામ અને બિખારી હોવાનું પ્રમાણપત્ર હતું. કાર્નેંગીએ તે ચકાસી જોયા પછી કહ્યું, “તારી ઓળખાણ તો આ પ્રમાણપત્રને લીધે મને થઈ ગઈ. પણ તું મને એ કહે કે ભીખ માગવાનો આ સમય છે ? અને ભીખ માગવાની આ તારી રીત બરાબર છે ? વહેલી સવારે આમ અમને સૌને પરેશાન કરનારને કોણ આપે ? ભીખ માગતાંથી તને નથી આવડતું.”

પેલા બિખારીની આંખમાં આ સાંભળતા ચમક આવી ગઈ અને તેણે જરા બેપરવાઈથી કહ્યું, “સાહેબ, તમે મોટા માણસ છો, એટલે કંઈ તમે સાચા છો એમ ન માનશો. દરેક ધંધાને તેની ટેકનીક હોય છે. મારા ધંધાની ટેકનીક હું જાણું, મહેરબાની કરીને મને તે વિશે કંઈ સલાહ ન આપશો. હું અત્યારે તમને તમારા ધંધા વિશે સલાહ આપું તો તે તમને ગમશો ? તમે તે સ્વીકારી શકશો ? જો આમ અત્યારે તમારા બંગલામાં ધૂસી ન ગયો હોત અને આટલો શોર મચાવ્યો ન હોત તો શું તમે મને મળવાના હતા ?”

ઓન્ડુ કાર્નેંગીને આ માણસનું સત્ય ગમ્યું. તેની મુશ્કેલી સાચી લાગતાં તેમણે તેના હાથમાં સો ડોલરની નોટ પકડાવતાં કહ્યું, “આ વખતે તો આપું હું પણ ફરીથી આમ આવીશ તો પાઈએ નહીં પરખાવું.”

પેલા બિખારીએ કહ્યું, “સાહેબ તમે વળી પાછી મને મારા ધંધા અંગે સલાહ આપી. હું તો

તમને મારા બિખારી હોવાનો પુરાવો આપી શક્યો; પણ કોઈ તમારી પાસે એવો પુરાવો માગે તો તમે મારી જેમ બિખારી હોવાનું સર્ટિફિકેટ લાવી શકશો ?” આ શબ્દો સાંભળતાં કાર્નેગીની આંખો લાલ થઈ ગઈ અને તેમણે કહ્યું, “તારી જીબ બહુ ચાલે છે. આ રીતે તો તને કોઈ કંઈ ન આપે. શું હું બિખારી છું ! માંગવું માંગવું અને વળી આટલો મિજાજ કરવો ?”

ભિખારીએ વિનમ્રતાથી  
કહ્યું, “સાહેબ, માફ કરજો, હું  
આમેય જૂહું બોલતો નથી. અને તમે  
સવારના પહોરમાં મને સો ડોલર  
આપ્યા છે તેથી તમારી પાસે તો  
જૂહું બોલું જ નહીં. પણ જરા વિચાર  
કરો કે તમે ભિખારી નથી ? ભલે  
તમે અઢળક સંપત્તિના માલિક છો.  
પણ તમે રોજ કમાવા નીકળો છો.  
તમે મારી જેમ ભિખારી હોવાનું  
સર્ટિફિકેટ ન રાખો પણ સૂક્ષ્મ રીતે  
તમે બધે ક્યાંક ને ક્યાંક માગતા  
રહેતા હશો. મારી અને તમારી  
વચ્ચે ફેર એટલો છે કે મારા હાથમાં  
ભિક્ષાપાત્ર છે. મારી પાસે સર્ટિફિકેટ  
છે, જ્યારે તમારા હાથમાં  
ભિક્ષાપાત્ર નથી અને ભિખારી  
હોવાનું સર્ટિફિકેટ નથી.” અને  
ભિખારી સલામ કરીને નીકળી  
ગયો.

ભિખારી તો ચાલ્યો ગયો  
પણ અબજોપતિ ઓન્નુ કર્નેંગી  
વિચારમાં પડી ગયા. આટલી  
સંપત્તિએ હું કમાવા નીકળું એટલે

ભિખારી તો ખરો જ. જેને કોઈની પાસે કંઈ  
મેળવવું છે તે ગમે તેટલો સમૃદ્ધ હોય છતાંય યાચક  
તો ખરો જ. ભલે હું હાથ લંબાવીને ભીખ ન  
માંગુ પણ સતત માગતો જ રહું છું. કોઈ પાસે  
વિવેકથી કામ કઢાવી લઉં, તો ક્યાંક સમજાવટથી  
રસ્તો કાઢી લઉં છું. આ બધું મારે કરવું પડે છે  
કારણ કે મારે કંઈક જોઈએ છીએ. મારી પાસે  
ધાણું છે. હવે શું હું અહીં અટકી ન શકું ?

જીવન-જ્યોત

- છીતુભાઈ ગોરધનભાઈ ભક્ત (વિદ્યાનગર) -

જીવનમાં લહેરાતો જા, સૌના મન બહેલાવતો જા,  
પગલે પગલે પાવન થઈને, ચારે દિશા મહેંકાવતો જા. (૧)

પ્રેમકળશ છલકાવતો જા, સૌની ખ્યાસ બુજાવતો જા,  
જ્ઞાનગંગાથી રચપચ થઈને, સરિતા જેમ વહાવતો જા. (૨)

દુર્ભિને સાંત્વન હેતો જા, કરુણાભાવ વરસાવતો જા,  
હુંખ વહેંચી ઘટાડતા જઈને, સુખ વહેંચી વધારતો જા. (૩)

કોધ-અહુમ ઓગાળતો જા, વેરજેર ભૂલાવતો જા,  
અવિરત સ્મિત રેલાવતા જઈ, મુસીબતો સામે ઝરુમતો જા. (૪)

ઉપકારનો બદલો ભૂલતો જા, ને પરોપકારી બનતો જા,  
જીવન બનજો ધૂપસળી સમ, ને સહનશીલતા જાળવતો જા. (૫)

મતભેદ તો થયા કરે, પણ મનભેદ નહિ, સમજાવતો જા,  
તરછોડી નાહકની ગપસપ, યોગી નહીં તો ઉપયોગી થા. (૬)

વ્યસન તો છે ધીમું જેર, પતનથી જિંદગી બચાવતો જા,  
અંધારા ઉલેચવાં કાજે, શ્રદ્ધા-દીપ પ્રગટાવ્યે જા. (૭)

જીતમાં રાખી અડીખમ વિશ્વાસ, નિર્ભય-ધૈર્યવાન બનતો જા,  
સંકટમાં બાથ ભીડી ભીડીને, શૌર્ય ને સાહસ દાખવતો જા. (૮)

વાત્સલ્યના સાગર ઉછાળતો જા, નફરતની આગ ઠારતો જા,  
સમસ્યા સામે પ્રસત્ર રહીને, સફળતાની કેડી કંડારતો જા. (૯)

ચાલશે, ફાવશે, ગમશે ને ભાવશે, આ જીવનમંત્ર રટાવતો જા,  
મૂઢી ઊંચેરો માનવ બનવા, જીવનજ્યોત જલાયે જા. (૧૦)

## અપ્રમત્ત યોગીશ્વર આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી

**આ. બ્ર. અલકાભેન (કોબા)**

અધ્યાત્મની પવિત્ર ધરા પર જે મણે અધ્યાત્મબોધ, ભક્તિયોગ તथા સિદ્ધાંતતત્ત્વ પ્રરૂપક ગ્રંથોની જ્ઞાનગંગા વહાવી એવા શ્રીમદ્ પૂજ્યપાદ આચાર્ય પાંચમી શતાબ્દીના એક મહાન સત્પુરુષ થઈ ગયા.

● જીવન પરિચય : શ્રીમદ્ પૂજ્યપાદ આચાર્યનો જન્મ કણાટકમાં ‘કોલે’ નામના ગામમાં માતા શ્રીદેવીની રત્નકુંશિથી થયો હતો. તેમના પિતાનું નામ માધવભદ્ર હતું. શ્રી પૂજ્યપાદ સ્વામીના પિતાશ્રીએ તેમની માતાના આગ્રહથી જૈનધર્મ અંગીકાર કર્યો હતો. તેમને કમલિની નામની એક બહેન હતી; જેનાં લગ્ન શ્રી ગુણભદ્રની સાથે થયાં હતાં. તેમને નાગાર્જુન નામનો એક વેદાન્તપ્રભર વિદ્વાન પુત્ર ઉત્પત્ત થયો હતો. સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન શ્રીમદ્ પાણિની તેમના મામા હતા.

એકવાર પૂજ્યપાદસ્વામી પોતાની વાટિકામાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક સાપે એક દેડકાંને પોતાના મોઢામાં પકડી લીધો છે અને તે તડપી રહ્યો છે. આ કરુણ દશ્ય જોઈને તેમણે અનિત્ય અને અશરણરૂપ સંસારથી વિરક્ત થઈને નિર્ગ્રથ જિનેશ્વરી દીક્ષા અંગીકાર કરી.

● બહુમુખી પ્રતિભાસંપત્ર વ્યક્તિત્વ : અધ્યાત્મયોગી, ભક્તકવિ, સિદ્ધાંતજ્ઞાની, વ્યાકરણજ્ઞાની અને દાર્શનિક વિચારસંપત્ર શ્રીમદ્ પૂજ્યપાદ સ્વામી અનેક વિષયોમાં પારંગત હતા. તેમનું મૂળ નામ શ્રી દેવનંદી હતું પરંતુ બુદ્ધિની અધિકતાના કારણે જિનેન્દ્રબુદ્ધિ અને દેવોએ આવીને તેમના ચરણોની પૂજા કરી હતી તેથી શ્રી પૂજ્યપાદ નામથી પ્રસિદ્ધ થયા. એવો ઉલ્લેખ આવે છે કે તેઓ પગમાં ગગનગામી લેપ લગાવીને વિદેહક્ષેત્રમાં સીમંધરસ્વામીના દર્શન કરવા જતા હતા. તેઓ ઘણા

દિવસો સુધી યોગાભ્યાસ કરતા હતા. એક દિવસ દેવવિમાનમાં બેસીને તેઓ અનેક તીર્થોની યાત્રા કરી રહ્યા હતા ત્યારે એક જગ્યાએ તેમની નેત્રજ્યોતિ લુપ્ત થઈ ગઈ ત્યારે તેમણે દેવાધિદેવ શાંતિનાથ ભગવાનની ભક્તિમાં “શાંત્યાષ્ટકં” રચ્યું, જેનાથી તેમની નેત્રજ્યોતિ પાછી આવી ગઈ.

કણાટક પ્રાંતમાં મૈસૂર શહેરની પાસે પવિત્ર કનકગિરિ નામનું ક્ષેત્ર તેમની તપોભૂમિ તથા સમાધિભૂમિ મનાય છે; જ્યાં તેમણે અનેક શાસ્ત્રોની રચના કરી હતી. તેમના દ્વારા રચિત ‘શ્રી સમાધિશતક’ નામનાં ગ્રંથનું પારાયણ આપણી સંસ્થામાં થાય છે.

● શ્રીમદ્ પૂજ્યપાદસ્વામીની રચનાઓ :

(૧) શ્રી દશભક્તિ સંગ્રહ, (૨) જન્માભિપેક, (૩) તત્ત્વાર્થવૃત્તિ (સર્વથિસિદ્ધિ), (૪) સમાધિતંત્ર, (૫) ઈષ્ટોપદેશ, (૬) જૈનેન્દ્ર વ્યાકરણ, (૭) સિદ્ધિ-પ્રિયસ્તોત્ર, (૮) વૈદ્યકીય (આયુર્વેદ) શાસ્ત્ર આદિ.

### પૂજ્યપાદ આચાર્યની સ્તુતિ

પૂજ્યપાદના પાદપત્રમાં, પૂજ્યભાવથી પુનિત વંદના. પંચમકાળની પાંચમી સદી,

દેવપૂજ્યના પાદપત્રમાં,  
અધ્યાત્મબોધની ભક્તિયોગની,

સિદ્ધાંતતત્ત્વની સુરસરી વહી;

દેવપૂજ્યના પાદપત્રમાં,

ત્રિયોગ શુદ્ધિથી ત્રિકાળ વંદના.

આપની દશા આ સાભ્યભાવના,

હું જ્ઞાતો નથી સ્વરૂપ સાધના,

ભક્તિવશ થઈ કરી ગુણાર્થના,

બાળબુદ્ધિની સ્વીકારો પ્રાર્થના;

સમાધિતંત્ર આ ગ્રંથને નમી,

નિજાત્મશુદ્ધિ હિત કરું આરાધના.

## ધારો તો તમે આખે આખા બદલાઈ શકો.

### ધૂળી માંડલિયા

કોઈવાર તમારા કાને આવા શબ્દો અથડાયા હશે, ‘જવા દોને યાર, એનો સ્વભાવ જ જગડાળું છે.’ ફ્લાણાભાઈ સ્વભાવે સારા અને ફ્લાણાભાઈ સ્વભાવે ખરાબ.’ એવા અભિપ્રાયો આપણે પણ કોઈના માટે ક્યારેક આચા હશે અથવા આપણે સાંભળ્યા હશે. તો પ્રશ્ન થાય છે કે માણસનો મૂળભૂત સ્વભાવ દેહાંતે પણ બદલાતો નથી? માણસ ધારે તો પોતાનો ખરાબ સ્વભાવ બદલી શકે ખરો? સ્વભાવનો મૂળગત અર્થ અધ્યાત્મ જે કહે છે એની અહીં વાત નથી. રોજબરોજના વ્યવહારમાં પ્રગટ થતાં માનવીય અભિગમની અહીં વાત છે. પોતાના ખરાબ સ્વભાવમાં પરિવર્તન લાવવું હોય તો પોતાની સમજણમાં પહેલા તો પરિવર્તન લાવવું પડશે. સાચી સમજણની વિચારયાત્રા જ માણસને બદલી શકે. ટૂંકમાં માણસ ધારે તો વાલિયામાંથી વાલ્મિકી બની શકે.

કોઈ માણસ જન્મથી જ રીંઠો ગુનેગાર કે સાધુસંત નથી હોતો. કોધી કાયમ કોધી અને સમતાભાવવાળો આજીવન સમતાભાવવાળો નથી હોતો. સંજોગ અને સમજણ પ્રમાણે માણસના સ્વભાવનું ઘડતર થતું રહે છે. આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. માણસના સ્વભાવનું પોત અનેક મિશ્ર જાડા-પાતળા તાણાવાણાથી બંધાતું હોય છે.

દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ નિરાળું હોય છે. આ આગવું એ જ એનો સ્વભાવ. માત્ર તે તેની કેટલી વધારે ધાર કાઢી શકે છે તે જોવાનું રહે છે. કેટલીક વ્યક્તિ એવી હોય છે કે જે આપણને અકળાવે, તો કેટલીક વ્યક્તિની ગેરહાજરી આપણને સાલે. ધારો કે તમે કોઈ પાર્ટી સમારંભમાં જરૂર શકતાં નથી. એવા સંજોગોમાં મિત્રોને તમારી ગેરહાજરી સાલે છે? તમે ઘરમાં ન હો, બહારગામ ગયા હો, ત્યારે તમારા કુટુંબીજનોને ખાલીપો લાગે છે? જો એનો જવાબ ‘હા’ હોય તો તેનો અર્થ એ કે તમારો સ્વભાવ સારો

છે, આનાથી વિસુદ્ધ હોય તો સ્વભાવમાં ફેરફારની જરૂર છે એમ સમજવું.

આપણે માત્ર થોડોક સમય રોકાઈને આપણી જાતનું નિરીક્ષણ કરતા રહેવાનું છે. આપણી મૂળભૂત વૃત્તિઓ, આપણી ગુંજયશ, આપણા દોષો તથા આવડતો અને આપણી સામેના સંજોગો તથા પડકારોને દરરોજ સમજતા રહીએ તો આજે આપણે જે છીએ તેના કરતા આવતીકાલે જુદી જ વ્યક્તિ હોવાની શક્યતા છે.

કેટલાક ભક્તો તીર્થયાત્રાએ જતા હતા. સંત તુકારામે તેમને કહ્યું, “મારાથી તો અવાય એમ નથી, પણ મારી આ તુંબડીને લઈ જાઓ. એને દરેક તીર્થમાં સ્નાન કરાવજો.”

ભક્તો અનેક તીર્થની જાત્રા કરીને પાછા આવ્યા. તેમણે તુંબડી પાછી આપીને કહ્યું, “અમે એને એક એક તીર્થમાં સ્નાન કરાવ્યું છે.”

તુકારામે એ જ તુંબડીનું શાક કરી ભક્તોને પીરસ્યું તો, ભક્તોએ થૂંકી નાખ્યું. કહે, “આ તો કડવી છે.” તુકારામે કહ્યું, “આટાટલાં તીર્થમાં સ્નાન કર્યું તોયે એ કેમ કડવી રહી ?”

ભક્તોએ કહ્યું, “એનો સ્વભાવ જ એવો, પછી તીર્થ શું કરે ?”

તુકારામે કહ્યું, “ખરી વાત, ગમે તેટલી જાત્રા કરીએ પણ આપણે યથાયોગ્ય વિવેકપૂર્વ વિચારવાનું જ મારી વાળીએ તો આપણો આત્મવિકાસ ના જ થાય.”

પ્રત્યેક વ્યક્તિની ઉશ્રતિનો મૂળ પાયો સમજણપૂર્વકના પુરુષાર્થમાં રહેલો છે. જો એમ થતું રહે તો માણસ આખેઆખો બદલાઈ શકે છે. કર્મકંડ અને શુદ્ધ સમજણ એક નથી. કર્મકંડ પુરુષાર્થ લક્ષી કરતા શ્રદ્ધાલક્ષી વધુ છે.

## સ્વાદ્યાય-સાર

### સંકલન : મિતેશભાઈ એ. શાહ

(આપણી સંસ્થામાં તા. ૮-૫-૨૦૧૧ થી તા. ૨૩-૫-૨૦૧૧ દરમાન સિદ્ધાંતરત્ન, ન્યાયરત્ન આદ.બા.બ્ર. પવનભૈયાની શ્રી અમૃતયંગાચાર્ય વિરચિત ‘પુરુષાર્થસિદ્ધયુપાય’ તથા આદ.બા.બ્ર. કમલભૈયાની શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત ‘રયણસાર’ ગ્રંથના આધારે સ્વાધ્યાયશૈખીનું આયોજન કરવામાં આવ્યું હતું; જેની રત્નકણિકાઓ ‘દિવ્યધ્વનિ’ ના સુજ્ઞ વાચકો માટે પ્રસ્તુત કરીએ છીએ.)

- શ્રદ્ધા + જ્ઞાન + આચરણ = શ્રાવક.
- જેમાં ગુણો નિવાસ કરે તેનું નામ દ્રવ્ય. દ્રવ્ય અને ગુણોની અવસ્થાનું પરિવર્તન થાય તે પર્યાય.
- અનેકાંત એ પરમાગમનો પ્રાણ છે. અનેકાંતમાં અનેક નય સમાય છે. અનેક અંત (ધર્મ-સ્વભાવ) જેમાં ગર્ભિત હોય તેને અનેકાંત કહે છે.
- પદાર્થના એક અંશના કથનને નય કહે છે. પર્યાયને અનુલક્ષીને જેમાં કથન કરવામાં આવે તે વ્યવહારનય (અભૂતાર્થ) અને દ્રવ્યનું અવલંબન લઈને જે કથન થાય તેને નિશ્ચયનય (ભૂતાર્થ) કહે છે. નિશ્ચયનય સુધી પહોંચવા વ્યવહારનું અવલંબન લેવું આવશ્યક છે. (ઉ.દા. ઈન્જેક્શન દ્વારા દવાનું શરીરમાં દાખલ થવું, આમાં ઈન્જેક્શનની સોંય વ્યવહારનય છે તો દવા નિશ્ચયનય છે.)
- આત્મા અને કર્માંની મિશ્ર અવસ્થાને સંસારી જીવ શુદ્ધ અવસ્થા માનો છે કારણ કે કર્મભલિનતાથી રહિત શુદ્ધાત્માની તેને અનુભૂતિ થઈ નથી.
- આત્માના ત્રાણ પ્રકારના સંબંધ : (૧) સંયોગ સંબંધ (શરીર સાથે આત્માનો સંબંધ); (૨) સંશ્લેષ સંબંધ (જ્ઞાનાવરણાદિ કર્મો સાથેનો સંબંધ); (૩) તાદાત્મ્ય સંબંધ (આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણો સાથેનો સંબંધ)
- આખી દુનિયાને જાણો પણ પોતાના સ્વરૂપને ન જાણો તેને સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ ન થાય.
- મિથ્યાત્વનો ત્યાગ, આત્મતત્વનું જ્ઞાન અને આત્મસ્વરૂપમાં રમણતા એ મોક્ષનો માર્ગ છે.
- અન્ય જીવોની સરખામણીએ મનુષ્યોની સંખ્યા (અદી દ્વીપમાં) સિદ્ધુમાં બિંદુ સમાન છે. સંયમની આરાધના મનુષ્યગતિ સિવાય અન્ય કોઈ ગતિમાં થઈ શકતી નથી.
- ધર્મની આરાધના કેવી રીતે કરવી ? સાધના તૂટે ના, શરીર ધૂટે ના.
- સમ્યગ્રદર્શન વિના જ્ઞાન અને ચારિત્ર એકડા વગરના મીઠા સમાન છે.
- લાભાંતરાયના ક્ષયોપશમથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે, માત્ર પુરુષાર્થ કરવાથી નહિ.
- લોકવ્યવહાર અને મોક્ષમાર્ગ એ બંને ઉદ્દેશ ના અંક જેવા છે ! પરમાર્થને સુરક્ષિત રાખી લોકવ્યવહાર કરનારા વીરલા છે.
- મનથી વધારે પાપભાવો થાય છે, પછી વચનથી અને કાયાથી.
- વાત્સલ્ય એ એવું શસ્ત્ર છે કે જેના ઉપયોગથી જીવ દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકે છે.
- સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત

જ્ઞાનને સમ્યક્જ્ઞાન કહે છે. સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ થતાં જ્ઞાન સમ્યકું બની જાય છે.

- જ્ઞાનીપુરુષોના સાત્ત્વિધમાં થતો તત્ત્વાભ્યાસ તત્ત્વની પ્રાપ્તિ કરાવે છે.
  - સંવિકાળ (સૂર્યોદય, સૂર્યાસ્ત, મધ્યાહ્ન, મધ્યરાત્રિ) દરમ્યાન સ્વાધ્યાય ન કરવો.
  - સમ્યક્જ્ઞાનના ૮ અંગો છે : શાબ્દચાર, અર્થચાર, ઉભયચાર, કાલાચાર, વિનયચાર, (ઉપધાનચાર, બહુમાનચાર, અનિક્ષ્વચાર).
  - સમ્યક્ચારિત્ર વિના મોક્ષમંજિલની પ્રાપ્તિ થતી નથી.
  - પાંચ ઈન્દ્રિયોમાં આસક્તિ વધતાં જ્ઞાન લુપ્ત થાય છે, ઈન્દ્રિયોના વિષયોમાં અનાસક્તિ થતાં અલ્પ અભ્યાસથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
  - સંપૂર્ણ કખાયરહિત અવસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર કરે છે.
  - સંકલ્પી, આરંભી, ઉદ્ઘોગી અને વિરોધી હિંસા પૈકી શ્રાવક સંકલ્પી હિંસાનો નિયમપૂર્વક ત્યાગ કરે છે.
  - હિંસાના બે પ્રકાર છે : (૧) દ્રવ્યહિંસા : જીવના ૧૦ પ્રાણો પૈકી કોઈ પણ પ્રાણનો નાશ કરવો. (૨) ભાવહિંસા : આત્મામાં રાગ-દ્વેષાદિ ભાવોની ઉત્પત્તિ થવી. આત્મામાં રાગાદિક વિભાવભાવોની ઉત્પત્તિ ન થવા દેવી તેનું નામ નિશ્ચય અહિંસા.
  - કોઈ કોઈને સુખી કે દુઃખી કરી શકતું નથી. પોતપોતાના કર્મ અનુસાર જીવને સુખ-દુઃખની પ્રાપ્તિ થાય છે.
  - હિંસાનો નિયમપૂર્વક ત્યાગ કરવો. નિયમ કે

પ્રત ધારણ ન કર્યા હોય તો હિંસા ન કરવા  
ઇતાં પણ હિંસાનો દોષ લાગે છે !

- પરિગ્રહે આપણને પકડ્યા નથી, આપણે પરિગ્રહને પકડ્યો છે !
  - આત્માના પરિણામ (ભાવ) બંધ-મોક્ષના મુખ્ય કારણરૂપ છે.
  - હિંસાની અનુમોદના કરવાથી પણ હિંસાનું ફળ પ્રાપ્ત થાય છે.
  - સજજનતાપૂર્ણ વ્યવહાર હુણ વ્યક્તિના પરિણામોને પણ બદલી નાખે છે.
  - ભાવશૂન્ય કિયા મોક્ષતુપી ફળ આપતી નથી.
  - જિનેન્દ્ર ભગવાનના નયચકને જ્ઞાની પુરુષો જ ધારણ કરી શકે છે.
  - હિંસાનો ત્યાગ કરવા ઈચ્છતી વ્યક્તિએ પ્રથમ અષ્ટ મૂલગુણોને ધારણ કરવાં આવશ્યક છે. (વડના ટેટાં, પીપળના ટેટાં, કંઠુંબર, ઉમરડા, અંજલી-આ પાંચ ફળોનો ત્યાગ + મધ્ય, માંસ અને મધનો ત્યાગ) આ અષ્ટ મૂલગુણોને ધારણ ન કરનાર જિનો શરની દેશના સાંભળવાને પણ પાત્ર નથી.
  - શરાબ (દાડુ) ના એક ટીપામાં એટલા જીવો હોય છે કે તે જીવો જો પારેવડાનું રૂપ ધારણ કરે તો આ લોકમાં પણ ન સમાય !
  - ચામડામાંથી બનેલા બૂટ, ચંપલ, પણ્ણા, પાકીટ વગેરેમાં પણ જીવોની ઉત્પત્તિ થતી રહે છે. આ પદાર્થોના સ્પર્શ માત્રથી પણ અનેક જીવોનો ઘાત થાય છે. માટે શ્રાવકે ચામડામાંથી બનતી વસ્તુઓના ઉપયોગનો નિયમપૂર્વક ત્યાગ કરવો.
  - મધ એ મધમાખીઓનું વમન છે. મધની પ્રાપ્તિ માટે ઘણા ગ્રસ જીવોની હિંસા થતી

હોવાથી તે અભક્ષ્ય છે.

- વલોણામાંથી માખણ કાઢ્યા પછી ૪૮ મિનિટમાં તેમાં તે જીતિના જીવોની ઉત્પત્તિ થતી હોવાથી માખણ અભક્ષ્ય પદાર્થ છે.
- શ્રાવકે ગ્રસ (હાલી-ચાલી શકે તેવા) જીવોની હિંસાનો નિયમપૂર્વક ત્યાગ કરવો જરૂરી છે અને સ્થાવર જીવોની રક્ષા માટે પણ યત્નાપૂર્વક વર્તાં જરૂરી છે.
- અહિંસાધર્મ એ એવું રસાયણ છે કે જેના સેવનથી જન્મ-મરણરૂપી રોગ નાશ પામે છે.
- એક વ્યક્તિ હિંસા કરવા છતાં હિંસાના ફળને પ્રાપ્ત થતી નથી. દા.ત. ઓપરેશન દરમ્યાન દર્દી મૃત્યુ પામે તો દાક્તરને હિંસાનું ફળ મળતું નથી. કેટલીકવાર હિંસા ન કરવા છતાં હિંસાનું ફળ પ્રાપ્ત થાય છે. દા.ત. માછીમારે માછલા પકડવા પાણીમાં જાણ નાખી પણ એક માછલું પકડાયું નહિ છતાં માછીમારને હિંસાનું ફળ પ્રાપ્ત થાય છે.
- કોઈને એક હિંસા તીવ્ર ફળ આપે છે, તો બીજાને તે જ હિંસા મંદ ફળ આપે છે. દા.ત. બે રીછ લડતાં લડતાં મરી ગયા. મુનિને બચાવનાર રીછ સ્વર્ગમાં જાય છે અને મુનિને મારવાની ભાવના રાખતું રીછ નરકમાં જાય છે.
- એક જીવ હિંસા કરે અને ઘણા જીવો તેનું ફળ ભોગવે છે. દા.ત. હિંસાની અનુમોદના કરનાર હિંસાનું ફળ ભોગવે છે. ઘણા લોકો હિંસા કરે પણ તેનું ફળ એકને મળે. દા.ત. યુદ્ધના મેદાનમાં રાજાના આદેશથી લડતા સૈનિકો હિંસા કરે છે તો તેનું ફળ રાજાને ભોગવાં પડે છે.
- પરનિદા અને સ્વપ્રશંસાથી નીચ ગોત્રનો બંધ

થાય છે.

- અસત્યના ચાર પ્રકાર છે : (૧) સત્તુઅપલાપ : વિદ્યમાન વસ્તુને ન કહેવી, (૨) અસત્તુઅપલાપ : અવિદ્યમાન વસ્તુને કહેવી, (૩) અન્ય રૂપાવિધાન : વસ્તુને અન્ય સ્વરૂપે કહેવી, (૪) પાપયુક્ત અને અપ્રિય કઠોર વચ્ચનો કહેવાં.
- ધનના માધ્યમથી દ્રવ્યપ્રાણની રક્ષા થાય છે તેથી ધનને ૧૧ મો પ્રાણ કહે છે ! માટે બીજાના ધનનું હરણ કરનાર તેના પ્રાણનું હરણ કરી લે છે.
- દ્રવ્યવેદ નામકર્મના ઉદ્યથી અને ભાવવેદ મોહનીયકર્મના ઉદ્યથી ઉદ્ભબે છે.
- પ્રતોમાં સૌથી કઠિન બ્રહ્મચર્ય વ્રત છે, કર્મોમાં સૌથી બળવાન મોહનીય છે, ઈન્દ્રિયોમાં રસના ઈન્દ્રિયને જીતવી કઠિન છે અને ગુપ્તિમાં મનોગુપ્તિ પાળવી અધરી છે.
- જ્યાં જ્યાં મૂર્ખ (આસક્તિ) છે ત્યાં ત્યાં પરિગ્રહ છે તેમ નિશ્ચયથી જાણો.
- બાધ્ય અને અંતરંગ પરિગ્રહને ધારણ કરવામાં હિંસા છે અને તેમના ત્યાગમાં અહિંસા છે.
- કર્મબંધની મંદતા-તીવ્રતાનો આધાર આત્માના પરિણામો (ભાવો) પર રહેલો છે.
- સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરવા સમર્થ ન હોઈએ તો પરિગ્રહની મર્યાદા તો અવશ્ય કરવી જોઈએ. ઉંમર વધતી જાય તેમ પરિગ્રહ ઓછો કરતા જાઓ.
- રાત્રિભોજન શા માટે ન કરવું ? (૧) રાત્રિભોજન કરવાથી સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે. (૨) સૂર્યપ્રકાશના અભાવે રાત્રે ખોરાકમાં શીતયોનિવાળા અસંખ્ય જીવોની

ઉત્પત્તિ થાય છે. (૩) શરીર પ્રત્યે તીવ્ર આસક્તિવાળા જીવો રાત્રિભોજન કરે છે.

(૪) રાત્રે ખાવું તે માંસ ખાવા સમાન છે અને પાણી પીવું તે લોહી પીવા સમાન છે.

- પાંચ વ્રતરૂપી નગરીની રક્ષા કરવા માટે શીલવ્રતો કિલ્લા સમાન છે.
  - સત્રદેવ-ગુરુ-ધર્મની સમ્યકું આરાધનાથી સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ઉત્તમ રત્નોની પ્રાપ્તિ થાય છે.
  - સમ્યકુદૃષ્ટિ સંસારમાં રહે છે, પણ સંસાર તેમનામાં પ્રવેશતો નથી.
  - શ્રાવક સદા નવ દેવતાઓ (પંચ પરમેણી, જિનધર્મ, જિનાગામ, જિનચૈત્ય, જિન ચૈત્યાલય) પ્રત્યે શ્રદ્ધાવાન હોય છે.
  - નિશ્ચયથી સંસાર એટલે રાગ-દ્રેષ.
  - શ્રાવક ધર્મના મુખ્ય બે પાયા છે - પૂજા અને દાન. મુનિધર્મના મુખ્ય બે પાયા છે - સ્વાધ્યાય અને ધ્યાન.
  - સાધનાસંપત્ત પુરુષોના ચરણોમાં સાધનસંપત્ત લોકો નમે છે.
  - કેટલાક મનુષ્યો ભગવાનને માને છે, પણ ભગવાનનું (કહ્યું) માનતા નથી !
  - ધર્મ કરવાની જ્યાં સગવડ મળે તેને ઉત્તમ કુળ કહે છે.
  - બાધ્યમાં પાપાચાર કરતા રહેવું ને અધ્યાત્મની પ્રાપ્તિ થવી તે અસંભવિત છે.
  - અસંયમી રહીને નરકમાં જવા કરતાં સંયમનું પાલન કરી સ્વર્ગમાં જવું બહેતર છે.

- ઉપદેશના પ્રભાવ કરતાં આચરણનો પ્રભાવ વધારે અસર કરે છે.
  - જેમ જેમ કખાયોનો નાશ થતો જાય તેમ તેમ ચાન્તિકદશા પ્રગટી જાય છે.
  - પહેલાં ભગવાનના દાસ બનો, પછી ભગવાન બનાશો.
  - દરેક પદાર્થનું પરિણામન સ્વતંત્ર છે. પોતાના શરીરની પરિણાતિ બદલી શકતા નથી તો અન્ય પદાર્થોની પરિણાતિ કેવી રીતે બદલી શકાય ?
  - પંચમકાળમાં ભયંકર વિષયભોગોની ભીડમાંથી આત્મારૂપી ગાડીને કાઢવા માટે સંયમરૂપી બ્રેક અને જિનેન્દ્રભક્તિરૂપી હોર્ન આવશ્યક છે.

ਮੇਕ ਅਸਥਾਰ

ધોર અંધારી રે રાતલડીમાં, દીકો એક અસવાર,  
શિવપુરપથે રે, સફર કરે એ, દિવસ-રાત મોઝાર.  
કોધ, માન, માયાને લોભને જીતવા, નીકળ્યો એ અસવાર,  
રાગ અને દ્વેષને જીતવા માટે, બન્યો એ કાળજાળ.  
આશા, ઈચ્છાને જીતી રહ્યો છે, સંયમ ધરી અપાર,  
રતિ-અરતિમાં સમાનભાવથી, વર્તી રહ્યો અસવાર.  
વિષયોને કાઢવા જૂમી રહ્યો છે, જાણે જંઝાવાત,  
માન-અપમાનનો ભેદ નથી કોઈ, ભયનો કર્યો છે ઘાત.  
શ્રુત, શીલ, વિનયને, ધરી રહ્યો છે, નરવીર એ અસવાર,  
દશવિધ ધર્મને આદરવા એ તો દોડી રહ્યો પૂરપાટ.  
મોક્ષ પુરુષાર્થમાં મચી રહ્યો છે, આ શૂર પુરુષ અપાર,  
સમતાભાવ વડે મથી રહ્યો છે, કરવા ભવનો પાર.  
જીતશે જીતશે એ મોહરાજાને, મહાવીર બની અસવાર,  
પામશે પામશે એ સિદ્ધાલયનું, સૂખ અનંત અપાર.

## ભાગ વિભાગ

સંકલન : મિતેશભાઈ એ. શાહ

### જીબ અને વિવેકબુદ્ધિ

હકીમ લુકમાની વિદ્વત્તાનો કોઈ પાર નહોતો. એમ છતાં એમણે કદી ઘમંડ કર્યો નહોતો. છેક બચપણથી જ એમનામાં જ્ઞાનનાં બીજ રોપાઈ ગયા હતા. પછી જેમ જેમ એ મોટા થતા ગયા તેમ તેમ તે જ્ઞાનબીજમાંથી વિદ્વત્તાનું એક મોટું વટવૃક્ષ જાણે ઊગી નીકળ્યું !

એ સમયે ઈરાનમાં ગુલામપ્રથા ચાલતી હતી. ધનાઢ્ય માણસના ત્યાં જો કોઈ ગુલામ ન હોય તો એની ધનાઢ્યતાની જાણે કોઈ કિંમત રહેતી નહિ ! હકીમ લુકમાન પણ એક કાળે કોઈ એક ધનવાનને ત્યાં ગુલામ હતા.

પણ આ ધનાઢ્ય માનવપારખું હતો. તેથી તેણે જાણી લીધું કે ગુલામ લુકમાન જ્ઞાની પુરુષ છે. આથી, લુકમાનને કોઈ ધરકામ સૌંપવાને બદલે તેણે કોઈ સમર્થ્યા કે કોઈ પ્રશ્નના ઉકેલમાં તેની સલાહ લેવાનું રાખ્યું હતું.

એકવાર ધનાઢ્યે લુકમાનને પોતાની પાસે બોલાવ્યો અને તેને કહ્યું, “આજે મારે તારી સમક્ષ એક પ્રશ્ન રજૂ કરવો છે. મારે એ જાણવું છે કે, આ માનવશરીરમાં સૌથી ઉત્તમ કર્દી ચીજ ગણી શકાય ?”

તરત જ લુકમાન બોલ્યો, “જીબ ! બીજું શું વળી ?”

માલિકે બીજો પ્રશ્ન કર્યો, “તો હવે તું એ કહે કે, આ માનવશરીરમાં સૌથી અધમ અંગ કયું ?”

લુકમાને કહ્યું, “જીબ જ !”

માલિકે આશ્રમ પામી પૂછ્યું, “એક જ વસ્તુ કદી ઉત્તમ અને અધમ હોઈ શકે ખરી ? શું જીબ ઉત્તમ પણ છે અને અધમ પણ છે ? આ તો કદી સંભવી શકે નહિ !”

“એ જ સંભવિત છે ! જીબમાં એટલી બધી મીઠાશ છે કે પોતાની મીઠાશથી તે કોઈ પણ વ્યક્તિના હદયને જતી શકે છે, પણ આ સાથે તેનામાં કડવાશ પણ એટલી બધી છે કે વાતવાતમાં તે કોઈ પણ વ્યક્તિને વેરી પણ બનાવી દે છે ! આમ, જીબમાં ભલાઈ પણ છે અને બુરાઈ પણ છે. આથી જ ડાખા માણસો જીબનો ઉપયોગ કરવામાં વિવેકબુદ્ધિ વાપરે છે.”

### દયાભાવના સંસ્કાર

ડૉ. આલ્બર્ટ સ્વાઈલર કિશોર હતા ત્યારે એકવાર એમના કેટલાક મિત્રો એમને એક જંગલમાં લઈ ગયા. જંગલમાં જઈને એ લોકો શિકાર કરવા માગતા હતા.

તેઓ એક ગીચ જાડી પાસે આવી પહોંચ્યા. એ જાડીમાં વિવિધ રંગનાં પક્ષીઓ આનંદથી મીઠો કલરવ કરી રહ્યાં હતાં. સ્વાઈલર આ અનુપમ પ્રકૃતિસૌંદર્યને જાણે આંખો દ્વારા ઘટક ઘટક પી રહ્યા હતા. એમના અંતરમાં કોઈ અપૂર્વ રસનો એક સ્ત્રોત વહેવા લાગ્યો.

પણ આ બાજુ એમના મિત્રોએ પક્ષીઓનો શિકાર કરવાની તૈયારી કરવા માંડી.

આમ, મિત્રોને શિકાર કરવા તત્પર થયેલા

જોઈને, ‘નિર્દોષ અને રૂપાળા, અનુપમ સ્વરે ગાઈ  
રહેલાં પક્ષીઓ હમણાં મોતની ગોટમાં જઈ પડશો’  
એવા ખ્યાલથી સ્વાઈટરના હૃદયમાં અનુકૂળાનો  
ધોધ વહેવા માંડ્યો અને એમની આંખમાં દ્યાના  
આંસુ ડોકાઈ રહ્યાં !

આ બાજુ પેલા મિત્રોએ પક્ષીઓ તરફ પોતપોતાની ગલોલો ઉંચી કરી કરી કે તે જ ક્ષણે નજીક આવેલા એક ચર્ચમાં ધંટારવ થયો. એ ધંટારવ સાંભળતાં જ પેલાં બધાં પક્ષીઓ ત્યાંથી ઉડી ગયાં.

આ જોતાં જ સ્વાઈલરના આનંદનો પાર  
રહ્યો નહિ.

અને એ મનોમન બોલી ઉઠ્યા, “ હે ઈશ્વર ! તને અમે દ્યાનો સાગર માનીએ છીએ તે આજે યથાર્થ બન્યું છે. તેં દ્યાસાગરે આવો ઘંટારવ કરાવીને આ ભોળાં પક્ષીઓનું જીવન મોતના મુખમાંથી ઉગારી લઈને એક મોટું દ્યાનું કામ કર્યું છે. હે ઈશ્વર ! માણસોમાં પણ તું આવો દ્યાનો ભાવ પ્રગટાવ, કે જેથી તેઓ કોઈ પક્ષીનો શિકાર કરવાનો વિચાર સુદ્ધાં કરે નહિ.”

એમનો આ દ્યાભાવ અને જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યેની એમની અનુકૂળ એમની જિંદગીના છેલ્લા શાસ સુધી રહ્યા અને એ દ્યાની એક જીવંત મૂર્તિ સમાન રહીને પોતાના જીવનને (બનાવુણ, બનાવી, ગયા).

શક્તિનો વ્યાય

આગાસિસ નામનો એક મહાન તત્ત્વચિંતક  
થઈ ગયો. જગતના મહાન તત્ત્વચિંતકોના નામોમાં  
તેનું નામ સમાવિષ્ટ છે.

આ આગામિસ ખૂબ સંતોષી હતો. તેણે કદ્દી ધનની ઈચ્છા કરી નહોતી. વિદ્યા અને

અભ્યાસ એ જ તેને મન સાચી સંપત્તિ હતી !

તેમનો એક મિત્ર ઘણો જ વ્યવહારકુશળ !

આવી વ્યવહારકુશળતાને લીધે જ તે ધનવાન બન્યો હતો. તેને આગાસિસની ગરીબ સ્થિતિ જોઈને મનમાં ખૂબ લાગી આવતું. એક દિવસ તે આગાસિસના ઘરે આવ્યો.

આગાસિસનું ધર એટલે જાણો સુદામાની  
જુંપડી જ જોઈ લો ! ગરીબાઈની ચાડી ખાતી એક  
શેતરંજી આગાસિસે પાથરી અને તેના પર પોતાના  
મિત્રને બેસાડ્યો.

થોડીવાર થઈ એટલે આગાસ્તિસને તેના આધનિક ભિત્તે કહેવા માંડ્યું, “મને બહુ વિચિત્ર લાગે છે કે, તમે આવા પ્રખર વિદ્વાન અને છતાં તમે પૈસો બનાવ્યો નહિ ! મને તમારી આ ગરીબ હાલત જોઈને ખૂબ નવાઈ લાગે છે.”

આગાસિસે કહ્યું, “એમાં નવાઈ પામવા જેવું શું છે, એ જ મને સમજાતું નથી.”

મિત્ર બોલ્યો, “અરે, તમારા કરતાં ઓછું ભણેલો પણ વધુ પૈસો ભેગો કરી શકે છે. મારો જ દાખલો જુઓને ! હું ઘણું જ ઓછું ભણ્યો છું, છતાં મેં સારા પ્રમાણમાં પૈસો ભેગો કર્યો છે !”

આગાસિસે કહ્યું, “જો ભાઈ, મારી પાસે  
પૂરતી શક્તિસંપત્તિ છે પણ પૈસો ભેગો કરવામાં  
મારી એ શક્તિનો હું વય કરવા માગતો નથી.  
આપણું આયુષ્ય એટલું બધું ટૂંકું છે કે, માણસ જો  
પૈસો વધારવામાં જ પોતાનો બધો સમય વ્યતીત  
કરે તો એના માટે માનવીય સત્કાર્યો કરવાનો  
સમય રહે જ નહિ. હું સત્કાર્ય માટેના સમયના  
ભોગે પૈસો ભેગો કરવાનું વિચારી પણ ન શકું.  
ખરેખર તો લક્ષ્મીના અભાવમાં જ આપણામાં  
સત્કાર્ય કરવાની ભાવના રહે દે !”



॥ Shri Param Krupalu Devay Namah ॥

# YUVA TIMES

Hame Jeena Sikha Diya

Inspired by PUJYA ATMANANDJI



## GOODNESS NEVER DIES

"Good morning," said the woman as she walked up to the man sitting on ground. The man slowly looked up. This was a woman who looked rich and belonged to a very high society family. The men's first thought was that she wanted to make fun of him, like so many others had done before.

"Leave me alone," he growled. To his amazement, the woman continued standing. She was smiling, "Are you hungry?" she asked.

"No," he answered sarcastically. "I've just come from dining with the president. Now go away." The woman's smile became even broader. Suddenly the man felt a gentle hand under his arm. "What are you doing, lady?" the man asked angrily. "I said to leave me alone."

Just then a policeman came up. "Is there any problem, ma'am?" he asked. "No problem here, officer," the woman answered. "I'm just trying to get this man to his feet. Will you help me?"

The officer scratched his head. "That's old Jack. He's been begging here for a long time. What do you want with him?"

"See that cafeteria over there?" she asked. "I'm going to get him something to eat and get him out of the cold for awhile." "Are you crazy, lady?" the homeless man resisted. "I don't want to go in there!" Then he felt strong hands grab his other arm and lift him up. "Let me go, officer. I didn't do anything." "This is a good deal for you, Jack," the officer answered. "Don't blow it."

With some difficulty, the woman and the police officer got Jack into the cafeteria and sat him at a table in a remote corner. It was the middle of the morning, so most of the breakfast crowd had already left and the lunch bunch had not yet arrived. The manager strode across the cafeteria and stood by his table. "What's going on here, officer?" he asked. "What is all this, is this man in trouble?"

"This lady brought this man in here to be fed," the policeman answered. "Not in here!" the manager replied angrily. "Having a person like that here is bad for business." Old Jack smiled embarrassingly. "See, lady. I told you so. Now if you'll let me go. I didn't want to come here in the first place."

The woman turned to the cafeteria manager and smiled. "Sir, are you familiar with Eddy and Associates, the banking firm down the street?" "Of course I am," the manager answered impatiently. "They hold their weekly meetings in one of my banquet rooms." "And do you make a goodly amount of money providing food at these weekly meetings?"

"What business is that of yours?"

I, sir, am Penelope Eddy, president and CEO of the company."

"Oh." The woman smiled again. "I thought that might make a difference."

She glanced at the cop who was busy stifling a giggle. "Would you like to join us in a cup of coffee and a meal, officer?"

"No thanks, ma'am," the officer replied. "I'm on duty."

"Then, perhaps, a cup of coffee to go?"

"Yes, mam. That would be very nice." The cafeteria manager turned on his heel, "I'll get your coffee for you right away, officer." The officer watched him walk away. "You certainly put him in his place," he said.

"That was not my intent. Believe it or not, I have a reason for all this." She sat down at the table across from her amazed guest. She stared at him intently, "Jack, do you remember me?"

Old Jack searched her face with his old, rheumy eyes. "I think so; I mean you do look familiar."

"I'm a little older perhaps," she said. "Maybe I've even filled out more than in my younger days when you worked here, and I came through that very door, cold and hungry."

"Ma'am?" the officer said questioningly. He couldn't believe that such a magnificently turned out woman could ever have been hungry.

"I was just out of college," the woman began. "I had come to the city looking for a job, but I couldn't find anything. Finally, I was down to my last few cents and had been kicked out of my apartment. It was February and I was cold and nearly starving. I saw this place and walked in on the off chance that I could get something to eat."

Jack lit up with a smile. "Now I remember," he said. "I was behind the serving counter. You came up and asked me if you could work for something to eat. I said that it was against company policy."

"I know," the woman continued. "Then you made me the biggest sandwich and enjoy it. I was afraid that you would get into trouble. Then, when I looked over and saw you put the price of my food in the cash register, I knew then that everything would be all right."

"So you started your own business?" Old Jack said.

"I got a job that very afternoon. I worked my way up. Eventually I started my own business that, with the help of God, prospered."

She opened her purse and pulled out a business card. "When you are finished here, I want you to pay a visit to a Mr. Lyons. He's the personnel director of my company. I'll go talk to him now and I'm certain he'll find something for you to do around the office."

She smiled. "I think he might even find the funds to give you a little advance so that you can buy some clothes and get a place to live until you get on your feet. If you ever need anything, my door is always open to you."

There were tears in the old man's eyes. "How can I ever thank you?" he said.

"Don't thank me," the woman answered. "To God, goes the glory. Thank Him. He led me to you."

Outside the cafeteria, the officer and the woman paused at the entrance before going their separate ways.

"Thank you for all your help, officer," she said.

"On the contrary, Ms. Eddy," he answered. "Thank you. I saw a miracle today, something that I will never forget. And, thank you for the coffee."

## સમાજ-સંસ્થા દર્શન

સંસ્થાન આગામી કાર્યક્રમોની તપ્રેખ

સંસ્થાના આગામી કાર્યક્રમોની રૂપરેખા નીચે મુજબ છે.

(૧)	તા. ૩-૭-૨૦૧૧ (રવિવાર) અખાડ સુદ-બીજ	શ્રી જિનમંદિર ધ્વજારોહણ દિન
(૨)	તા. ૧૪-૭-૨૦૧૧ થી તા. ૧૭-૭-૨૦૧૧ (ગુરુવાર થી રવિવાર)	શ્રી ગુરુપૂર્ણિમા શિબિર
(૩)	તા. ૨૫-૮-૨૦૧૧ થી તા. ૧-૯-૨૦૧૧ (ગુરુવાર થી ગુરુવાર)	શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના
(૪)	તા. ૧૩-૧૦-૨૦૧૧ (ગુરુવાર) આસો વદ એકમ	શ્રી આત્મસિદ્ધિ રચનાદિન
(૫)	તા. ૨૪-૧૦-૨૦૧૧ થી તા. ૨૭-૧૦-૨૦૧૧ (સોમવાર થી ગુરુવાર)	શ્રી દીપાવલી આરાધના શિબિર
(૬)	તા. ૨૮-૧૦-૨૦૧૧ થી તા. ૩૦-૧૦-૨૦૧૧ (શુક્રવાર થી રવિવાર)	યુવાશિબિર
(૭)	તા. ૧૦-૧૧-૨૦૧૧ (ગુરુવાર)	પરમહૃપાળુટેવની જન્મજયંતી
(૮)	તા. ૧-૧૨-૨૦૧૧ થી તા. ૩-૧૨-૨૦૧૧ (ગુરુવાર થી શાનિવાર)	પૂજ્યશ્રીના જન્મદિન નિમિતે આધ્યાત્મિક શિબિર

ઉપરોક્ત કાર્યક્રમોમાં પધારવા આપ સૌને ભાવભીનું નિમંત્રણ છે.

સંસ્થા દ્વારા આયોજિત આગામી લેખિત કસોટી

ફેલ્બુઆરી તથા માર્ચ મહિનામાં જે લેખિત કસોટી લેવામાં આવી હતી, તે જે પદ્ધતિથી હવે પછીની લેખિત કસોટી ગુરુપૂર્ણિમા શિબિરના આગલા દિવસે, તા. ૧૩ જુલાઈના બપોરે કોબામાં લેવામાં આવશે. કસોટીપત્રનો વિષય છે - ‘સાધક-સાથી’ પુસ્તકમાંથી પ્રકરણ નં.૪ બ્રહ્મચર્ય, ૧૨-નિર્માહીપણું, ૨૦-ત્યાગધર્મ, ૩૧-સંયમ અને ૪૪-તપ. દસલક્ષણા ધર્મના બાકી રહેલાં પાંચ ધર્મને આમાં આવરી લીધાં છે.

સદ્ગ્રામંચન, અભ્યાસ, ચિંતન-મનન, પ્રમાણ-જ્ય આદિથી સાધનાની પુષ્ટિ એ જ લક્ષ રાખી કસોટીપત્રને બને એટલું સરળ રાખવા માટે તેનું મુખ્ય પ્રારૂપ આ રીતે રહેશે : (૧) મુખ્યપણે ઓળજેકટીવ પ્રશ્નો (૨) જેઓ કોબામાં ન હોય તેઓ ઘરે બેસીને પરીક્ષા આપી શકશે. (૩) પુસ્તકની મદદ લઈ શકશે. (૪) જવાબ-પત્ર પ્રમાણે સ્વ-મલ્યાંકન. (૫) ગણ કૃત્યાંય જીહેર કરવામાં નહીં આવે. પ્રશ્નપત્ર

/ જવાબ-પત્ર મેળવવા દીઘ્યતા મુમુક્ષુઓએ આ ઈ-મેઈલ પર સંપર્ક કરવો ashok.koba@gmail.com (અગાઉના પ્રશ્નપત્ર જેમને જોઈતા હોય તેઓ પણ અહીં સંપર્ક કરી શકે છે.)

**સંસ્થા દ્વારા રાહતદરે નોટબુકો તથા ચોપડાઓનું વિતરણ**

વિદ્યાર્�ીઓને રાહતદરે નોટબુકો તથા ચોપડાઓ મળી શકે તે હેતુથી સંસ્થા દ્વારા જૂન માસમાં તેનું વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ રજૂ કરી સંસ્થાના કાર્યાલયમાંથી નોટબુકો તથા ચોપડાઓ મેળવી લેવા. આ જ્ઞાનદાનના કાર્યમાં આર્થિક સહયોગ આપવા વિદ્યાપ્રેમી દાતાઓને વિનંતી છે.

જીવનદેણિ - દિવાળી પુસ્તિકા

સમાજમાં સુવિચારોનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી આપણી સંસ્થા દ્વારા છેલ્લા ગ્રીસ વર્ષથી દિવાળી પુસ્તિકાઓ બહાર પાડવામાં આવે છે. નૂતન વર્ષ ૨૦૬૮ માટે ‘જીવનદિન’ દિવાળી પુસ્તિકા પ્રકાશિત કરવાનું સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. પુસ્તિકાને મહાપુરુષોના પ્રેરક પ્રસંગો, વિદ્યાનોના લેખો, રન્કષિકાઓ, સુવિચાર, સંતોની અમૃતપ્રસાદી, આરોગ્યની જાળવણી, માતા-પિતાનું મૂલ્ય જેવી અનેકવિધ રસપ્રદ માહિતીથી સજાવવામાં આવી છે. દિવાળી પુસ્તિકા અંગે વિશેષ માહિતી હવે પછીના અંકમાં આપીશું.

આપણી સંસ્થામાં ભગવાન-ગુરુની પ્રતિમાજુની પ્રતિષ્ઠા તથા સંતોના

## ચિત્રપટની સ્થાપનાવિદ્યિ ઉલ્લાસભેર વાતાવરણમાં સંપર્ક

આપણી સંસ્થા સાથે જોડાયેલ આદ.શ્રી સુવાણાબેન જ્યેશભાઈ જૈને વધુ ને વધુ સમય સંસ્થામાં રહીને સાધના કરી શકાય તે હેતુથી નૂતન સાધનાકુટિરનું નિર્માણ કરાવેલ છે. તા. હ-પ-૨૦૧૧, વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા) ના શુભદિને તેઓશ્રીની સાધનાકુટિરમાં, પૂજ્ય સંતશ્રી આત્માનંદજ્ઞના પાવન સાન્નિધ્યમાં ભગવાન - ગુરુની પ્રતિમાજ્ઞની પ્રતિષ્ઠા, વચનામૃતજ્ઞની તથા સંતોના ચિત્રપટની સ્થાપનાવિધિ ભક્તિસભર ઉલ્લાસભેર વાતાવરણમાં સંપત્ત થયેલ છે.

પ્રતિષાની પૂર્વ સંધ્યાએ ક્ષેત્રવિશુદ્ધિ અર્થે મંત્રજાપ તથા ભક્તિસંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભક્તહંદ્યો ભક્તિરસથી પ્લાન્ચિત બન્યા હતા.

તા. ૬-૫-૨૦૧૧ ના રોજ સવારે અભિષેક બાદ સંસ્થાના જિનમંદિરમાંથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે અંતર્ગત શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી ગૌતમસ્વામી, અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંડિંદ્રચાર્યજીની પ્રતિમાઓ, વચનામૃતજી તથા પરમહૃપાળુદેવના ચિત્રપટ સાથે ઉલ્લસિત ભક્તજનો મંત્રજાપ-ધૂનના ઉચ્ચાર સહ આનંદથી જૂમી રહ્યા હતા. પવિત્ર ભક્તિસભર વાતાવરણ સર્જયું હતું. જ્ઞાણે પ્રભુ-ગુરુની ભક્તિનું પૂર ન ઉમટ્યું હોય!

શોભાયાત્રા શ્રી સુવણ્ણબેનની સાધનાકુટિરમાં પહોંચ્યી. ત્યાં પણ સંસ્થાના ભક્ત સાધકોએ ભાવવાઢી ભક્તિરસ પીરસી સૌને પ્રભ-ગુરુમય બનાવ્યા હતા.

સાધનાકુટિરમાં શ્રી ઋખભદ્રેવ ભગવાનની દવ્ય-ભાવપૂજા કરવામાં આવી. ત્યારબાદ પૂજયશ્રી આત્માનંદજીના વરદહસ્તે ઝેં, સ્વસ્તિ વચ્ચના લેખન બાદ પ્રતિમાજીઓની પ્રતિજ્ઞા તથા ચિત્રપટોની સ્થાપના ખૂબ ઉલ્લાસભેર વાતાવરણમાં કરવામાં આવી.

આ પ્રસંગે શ્રી જ્યેશભાઈ / સુવાર્ષાબેનના સગા-સંબંધીઓ તેમજ મુમુક્ષુ ભાઈ-બહેનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી સુવાર્ષાબેન જ્યેશભાઈ જૈન પરિવાર તરફથી નવકારશી તથા સ્વામિવાત્સલ્ય રાખવામાં આવેલ.

### વરસીતપના પારણા

આપણી સંસ્થા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા તપસ્વી મુમુક્ષુ આદ. શ્રી સુવાર્ષાબેન જ્યેશભાઈ જેને કર્માની નિર્જરા અર્થે વરસીતપની આરાધના કરી હતી. વૈશાખ સુદ ગ્રીજ (અક્ષયતૃતીયા) ના દિવસે આપણી સંસ્થામાં તેઓશ્રીની પારણાવિધિ સંપત્ત થઈ. પૂજયશ્રી આત્માનંદજીના વરદહસ્તે તેઓશ્રીને પારણા કરાવવામાં આવ્યા. આ પ્રસંગે અનેક મુમુક્ષુ ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી તપસ્વીને પારણા કરાવી વરસીતપની અનુમોદના કરી હતી. સમસ્ત કોબા પરિવાર શ્રી સુવાર્ષાબેનના વરસીતપની અનુમોદના કરે છે અને તેઓ ધર્મપંથે ખૂબ પ્રગતિ કરી આત્મકલ્યાણ કરતા રહે તેવી શુભ ભાવના ભાવે છે.

### સંસ્થા સ્થાપના દિન

આપણી સંસ્થાએ ઉદ્ઘાટન પૂર્ણ કરી ઉજ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તા. ૮-૫-૭૫ વૈશાખ સુદ-૧૦ ભગવાન મહાવીરના કેવળજ્ઞાન કલ્યાણકના શુભ દિને આપણી સંસ્થાનો પ્રારંભ થયો હતો.

તા. ૧૩-૫-૨૦૧૧ વૈશાખ સુદ-૧૦ ના દિવસે સંસ્થાના સંસ્કરણો અને સંસ્થાની વિકાસયાત્રા પ્રસ્તુત કરતાં પૂજયશ્રી આત્માનંદજીએ જણાવ્યું કે આપણું મુખ્ય ધ્યેય તો આધ્યાત્મિક સાધના છે, સાથે સાથે સમાજકલ્યાણની ગ્રવૃત્તિઓ પણ કરવાની છે. સેવા અને અધ્યાત્મના સંસ્કારો નવી પેઢીમાં પણ આવિર્ભૂત થાય તેવા પ્રયત્નો પણ આપણે કરવાના છે. સંસ્થાની વિકાસયાત્રામાં સહયોગ આપનાર મહાનુભાવોનું પૂજયશ્રીએ ગુણપ્રમોદની ભાવનાથી પ્રેરાઈને સ્મરણ કર્યું હતું.

### આપણી સંસ્થામાં બા.બ્ર. આદ. પવનભૈયા તથા બા.બ્ર. આદ. કમલભૈયાની સ્વાધ્યાયશ્રેણી સાનંદ-સંપત્તા

આપણી સંસ્થામાં તા. ૮-૫-૨૦૧૧ થી તા. ૨૩-૫-૨૦૧૧ દરમ્યાન સિદ્ધાંતરણ, ન્યાયરણ બા.બ્ર. પવનભૈયા તથા બા.બ્ર. કમલભૈયાની સ્વાધ્યાયશ્રેણી સાનંદ-સંપત્ત થઈ. આદ. શ્રી પવનભૈયાએ શ્રી અમૃતયંત્રાચાર્ય વિરચિત પુરુષાર્થસિદ્ધ્યુપાય ગ્રંથના આધારે તથા આદ. કમલભૈયાએ શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત ‘રયણસાર’ ના આધારે સ્વાધ્યાય આપ્યા હતા, જેનો ટૂંકસાર આ અંકમાં અન્યત્ર આપેલ છે. તેઓએ પોતાની આગવી સરળ છતાં સચોટ અને રસપ્રદ શૈલીમાં, ચારેય અનુયોગોનો સમન્વય કરીને સ્વાધ્યાય આપ્યા હતા. આદ. બા.બ્ર. શ્રી પવનભૈયાએ નકશાઓના અવલંબન દ્વારા અઢીક્રીપની સુંદર સમજૂતી આપી હતી. સંસ્થાના મુમુક્ષુઓને મહાન આચાર્યની અનુભવવાણીનો આસ્વાદ ચખાડવા બદલ જૈન ઉદાસીન આશ્રમ, ઈસરી (જારખંડ) થી પધારેલા બા.બ્ર. પવનભૈયા તથા બા.બ્ર. કમલભૈયા પ્રત્યે સંસ્થા તરફથી સાભાર ધન્યવાદની લાગણી વ્યક્ત કરીએ છીએ.

સાભાર સ્વીકાર

પૂજય સ્વ. જિતા બાપજીની પ્રેરણથી લક્ષ્મીપુરા મુમુક્ષુમંડળ તરફથી સંસ્થાને ૨૦૦ મણ ઘઉં દાન સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે, જેનો સંસ્થા સાભાર સ્વીકાર કરે છે. લક્ષ્મીપુરા મુમુક્ષુમંડળ દ્વારા સંસ્થાને આ રીતે દાન મળતું રહે છે. લક્ષ્મીપુરા મુમુક્ષુમંડળની સંસ્થા પ્રત્યે રહેલી સંદૂભાવનાને બિરદાવી અનેકશા: ધન્યવાદ પાઠવીએ છીએ.

તા. ૧-૬-૨૦૧૧ના રોજ સંસ્થાના સત્ત્રીક કર્મચારીશ્રી દશરથભાઈ પટેલના જન્મદિન નિમિત્તે  
તેઓશ્રી તરફથી ફુટસલાડ રાખવામાં આવ્યો હતો.

**ਪ੍ਰਾਯ ਲਧੁਰਾਜ਼ਖਾਮੀ ਏਹੋਤਸਾਗਦਿਨ**


પરમહૃપાળું શ્રીમદ્ રાજયંત્રજીના શિષ્યરત્નો પૈકી પૂજ્ય લઘુરાજસ્વામી (પૂજ્ય લલ્બુજ્જ મહારાજ) અત્યંત આજ્ઞાંકિત, વિનમ્ર અને ભક્તસાધક હતા. તેઓ શ્રીના દેહોત્સર્ગ દિન વૈશાખ સુદ-૮ ના દિવસે સંલગ્ન સંસ્થા શ્રી સદ્ગુરુપ્રાસાદ, મીઠાખળી, અમદાવાદ મુકામે પૂજ્ય લઘુરાજ સ્વામીજીના ભક્તિપદોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેના અંતર્ગત આપણી સંસ્થાના મુમુક્ષુ ભાઈ-બહેનોએ પૂજ્ય લઘુરાજ સ્વામી પ્રત્યે પોતાના ભક્તિભાવો પ્રદર્શિત કર્યા હતા.

## ધર્મ ન બીજે દયા સમાન

આપણી સંસ્થાના ભોજનાલય વિભાગમાં સેવાઓ આપનાર શ્રી કોકીબેન રાવળનું જૂના કોબે મુકામે મકાન પડી જતાં સંસ્થાના મુમુક્ષુઓએ ફાળો એકત્ર કરી નવું મકાન બનાવી આપ્યું હતું. પૂજ્ય બહેનશ્રીના વરદાહસ્તે નૂતન મકાનની અર્પણવિધિ રાખવામાં આવી. આ પ્રસંગે સંસ્થાના અનેક મુમુક્ષુ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

# જૈન સમાજમાં નવી ક્ષિતિજે સર્જનારી પદ્મશ્રી ડૉ. કુમારપાણ દેસાઈની ‘ગૌતમ-કથા’

શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા તાજેતરમાં ૧૫ થી ૧૭ એપ્રિલ, ૨૦૧૧ દરમિયાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર, મહાન તપસ્વી અને અનંત લભ્યિઓના નિધાન શુરૂ ગૌતમસ્વામી વિરો સુપ્રસિદ્ધ સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની ‘ગૌતમ-કથા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રાણે દિવસ શુરૂ ગૌતમસ્વામીના જીવનની વિશેષતા, એમના ચિંતનની ગણનતા, ગુણોની સમૃદ્ધિ, અપ્રતિમ ગુરુભક્તિ અને અજોડ દર્શનને હૃદયસ્પર્શ શૈલીમાં ડૉ. કુમારપાળ દેસાઈએ પ્રસ્તુત કર્યું હતું, જેમાં ગુરૂ ગૌતમસ્વામીના જીવનના કેટલાંક અધ્રગટ પાસાંઓને ઉજાગર કરવામાં આવ્યા હતાં



આ ત્રણેય દિવસો દરમિયાન મહાવીર શાહ અને તેમના સાથીઓએ કથાના પ્રારંભ અને અંતે ધૂનથી અને ગીતોથી ભક્તિમય વાતાવરણ સજ્જ્યુ હતું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘે યોજેલા આ વિશિષ્ટ, વિરલ અને આયોજનપર્વકના કાર્યક્રમને સૌથે એક અવાજે વધાવી લીધો હતો.

ત્રણ-ત્રણ દિવસ સુધી ચાલેલી ગુરુ ગૌતમસ્વામીના જીવન અને ચિંતનની આ કથાએ શ્રોતાઓને જુદો જ અનુભવ કરાવ્યો. આજ સુધી પ્રથમવાર આ પ્રકારની તત્ત્વચિંતનસભર હદ્યસ્પર્શી વાણીમાં કથા સાંભળીને ઉપકૃત થયાનો સૌને અનુભવ થયો અને એથી જ શ્રોતાજનોએ આવતે વર્ષે ‘ઋષભક્થા’નું આયોજન કરવાની તીવ્ર ઈચ્છા પ્રગટ કરી હતી; જે પદ્મશ્રી ડૉ. કુમારપાણ દેસાઈએ સ્વીકારી હતી. આ ગૌતમકથાની ત્રણે દિવસ ‘માય ચેનલ’ ટીવી પરથી રજૂઆત થઈ હતી અને ત્યારબાદ ‘અરિહંત ચેનલ’ દ્વારા સમગ્ર દેશ અને વિદેશમાં પ્રસારિત કરવામાં આવી હતી.

### શ્રી સર્વમંગલમ् આશ્રમ સાગોડિયા મુકામે ‘આત્મ-આરાધન કેન્દ્ર’ ઉદ્ઘાટન સમારોહ સાનંદ સંપત્તિ

પરમપૂજ્ય ભાનુવિજયજી મહારાજની નિશામાં તા. ૩૦-૪-૨૦૧૧ થી તા. ૧-૫-૨૦૧૧ ના રોજ પૂજ્ય શ્રી સાધુ-સંતો, મહાનુભાવોના સાનિધ્યમાં ઉપરોક્ત કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પૂજ્યશ્રી ગોકુળભાઈ, આદ. વિદ્વદ્વર્ય ડૉ. સાગરમલ જૈન તથા આદ. શ્રી રસિકભાઈ દોશીના શુભહસ્તે કરવામાં આવ્યું હતું. અતિથિવિશેષ તરીકે આદ. પદ્મશ્રી ડૉ. કુમારપાણભાઈ દેસાઈ તથા આદ. શ્રી ગુણવંતભાઈ બરવાળિયા પદ્ધાર્ય હતા.

પૂજ્ય મહારાજશ્રીની હદ્યની ભાવના પ્રમાણે કોઈપણ જાતના ભેદભાવ વગર સૌ સાધુ-સંતો તથા ગૃહસ્થ સાધકો માટે આ ‘આત્મ આરાધન કેન્દ્ર’ અર્પણ કરવામાં આવેલ છે.

આદ. વિદ્વદ્વર્ય પં. સાગરમલજીએ તેમના ઉદ્ઘોધનમાં જણાવ્યું હતું કે ધર્મની આરાધના દ્વારા આપણે આત્મસ્વરૂપની ઓળખાણ કરવાની છે.

પૂજ્યશ્રી ગોકુળભાઈએ તેમના ઉદ્ઘોધનમાં જણાવ્યું હતું કે જ્યારે આપણો આત્મસાક્ષાત્કારનો ઉદેશ સફળ થાય ત્યારે ખરું ઉદ્ઘાટન થાય. આદ. સાહિત્યકારશ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ જણાવ્યું હતું કે આપણા ચતુર્વિધ સંઘને જોડતી કરી નબળી છે. જેમ શ્રમણ-શ્રમણી છે તેમ ‘વિદ્યાપુરો’ જોડતી કરી બની શકે.

પૂજ્ય શ્રી પુંડરિક મહારાજ સાહેબે જણાવ્યું કે નવપદના કેન્દ્રમાં સાધુપદ છે. તેઓ નિર્ણથ છે. નિર્ણથને કોઈ ભાવની પકડ ન હોય.

આદ. ડૉ. કુમારપાણભાઈએ તેમની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, સર્વ સંપ્રદાયોમાં પરસ્પર પ્રેમની ભૂમિકા સર્જવી જોઈએ. આ સર્વમંગલમ્ આત્મ આરાધના કેન્દ્ર પ્રત્યેક મનુષ્યની ભીતરમાં રહેલા આત્માને ઢંઢોળશે અને સત્ત્ર-ચિત્ત-આનંદની અનુભૂતિ કરાવશે.

પૂજ્યશ્રી ભાનુવિજયજી મહારાજે તેમના બોધમાં જણાવ્યું કે આત્માની બે પત્ની છે - સમતા અને મમતા. સમતા પત્રિતા છે અને મમતા કુલટા છે. આત્મા અત્યારે કુલટાને ધેર છે, તેને સમતાને ધેર લાવવાનો છે.

આ ઉપરાંત પૂજ્યબહેન શ્રી ડૉ. શર્મિષ્ઠાબેને પ્રાસંગિક ઉદ્ઘોધનમાં પૂજ્યશ્રી આત્માનંદજીનો શુભેચ્છા સંદેશ પાઠ્યો હતો અને સાધુ-સંતો તથા ગૃહસ્થ સાધકો આ કેન્દ્રનો લાભ લઈ પોતાના આત્માની ઉત્ત્રતિ સાથે એવી શુભભાવના વ્યક્ત કરી હતી.

તા. ૩૦-૪-૨૦૧૧ ની સાંજે આદ. શ્રી દીપકભાઈ બારડોલીવાળાએ નવપદની ભાવવાહી ભક્તિ કરાવી હતી. આપણી સંસ્થામાંથી કેટલાક મુમુક્ષુઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આપણી સંસ્થામાં આદ. શ્રી સુવણાભેન જ્યેશભાઈ કૈનની સાધનાકુટિરમાં ભગવાન-ગુરુની પ્રતિમાજીર્ણોની પ્રતિષ્ઠા તથા સંતોળા ચિત્રપટની સ્થાપનાવિધિ વેળાની તસવીરો (તા. ૬-૫-૨૦૧૧)



શોભાચાત્રાની વેળાએ



સ્વસ્તિ વચનોનું આલોખન

### પ્રતિષ્ઠા વેળાએ



પ્રભુજ્યશ્રીનું પાવન સાહિદ્ય



પ્રતિષ્ઠિત પ્રતિમાજીર્ણો તથા ચિત્રપટો

Registered under RNI No. : GUJGUJ/2008/25883

Permitted to post at Ahmedabad PSO on 15th of every month under Postal  
Regd. No. : GAMC - 309/2009-11 issued by SSP Ahmedabad valid upto 31-12-2011  
Licence to post without prepayment No. CPMG/GJ/36/2009-11 Valid upto 31-12-2011

આપણી સંસ્થામાં પૂજ્ય આચાર્ય ૧૦૮ શ્રી ભરતસાગરજી મહારાજના  
આગમન વેળાની તસવીરો (તા. ૭-૫-૨૦૧૧)



આ અંકના વિશિષ્ટ સહયોગી દાતા

‘દિવ્યધનિ’ જૂન-૨૦૧૧ ના અંક માટે રૂ. ૧૧,૦૦૦/-નો આર્થિક સહયોગ

**૧ સ્ય. શ્રી શિવુભાઈ વસનજી લાઠીયાના સ્મરણાર્થે**  
હસ્તે. શ્રીમતી હેમલતાબેન લાઠીયા પરિવાર (લાઠીયા રબર- મુંબઈ)  
તરફથી પ્રાપ્ત થયેલ છે. સંસ્થા તેઓશ્રીના આ ‘ઝાનદાન’ની અનુમોદના કરે છે.

‘દિવ્યધનિ’ જૂન-૨૦૧૧ ના અંક માટે રૂ. ૧૧,૦૦૦/-નો આર્થિક સહયોગ

**૨ આદ. શ્રી પરમાનંદભાઈ મોહનલાલ તલાટી**  
(અમદાવાદ)

તરફથી પ્રાપ્ત થયેલ છે. સંસ્થા તેઓશ્રીના આ ‘ઝાનદાન’ની અનુમોદના કરે છે.